

ઃ પાણીજન્ય રોગચાળો અટકાવવા માટેનો એકશન પ્લાન ૻ:

૧. અમદાવાદ શહેર

અમદાવાદ શહેરની સ્થાપના ઈ.સ. ૧૪૧૧માં થઈ હતી. જેને ૬૦૦ વર્ષ પૂર્ણ થયેલ છે. અમદાવાદ શહેર ભારત દેશમાં ૭(સાતમા) નંબરે અને ગુજરાત રા ધનું સૌથી મોટું સાબરમતી નદીના કિનારે આવેલું શહેર છે. બોમ્બે રા ધના ભાગલાં પછી અમદાવાદ શહેર સને ૧૮૬૦ પછી ગુજરાત રા ધની રાજધાની હતી અને સને ૧૮૭૦માં ગાંધીનગર ખાતે આ રાજધાની શીફ્ટ કરવામાં આવેલ. અમદાવાદ શહેરની વસ્તી સને ૧૮૮૧માં ૨૮.૭૭ લાખ જેટલી હતી અને સને ૨૦૦૧માં ૩૫.૦૦ લાખ તેમજ સને ૨૦૧૧ના સેન્સસ મુજબ આશરે ૫૬.૬૮ લાખ જેટલી વસ્તી નોંધાયેલ છે. જેનો વિસ્તાર સને ૧૮૮૧માં ૧૬૦.૮૪ ચો.કીલો મીટરથી વધીને વર્ષ-૨૦૧૧માં ૪૬૭ ચો. કીલો મીટર યાપેલો છે. અમદાવાદ શહેરનું સુચારુ સંચાલન માટે વહીવટી વિકેન્દ્રીકરણ કરી અમદાવાદ શહેરને દ (ઇ) ઝોન (ઉત્તર/દક્ષિણ/મધ્ય/ પૂર્વ/પશ્ચિમ/ નવા પશ્ચિમ) માં વહેચાયેલ છે. દરેક ઝોનને ૮૦,૦૦૦ની વસ્તી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૬૪ વૉર્ડ કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ દ (ઇ) ઝોન માટે આરોગ્ય વિભાગના મુખ્ય વડા તરીકે આરોગ્ય અધિકારીશ્રીને નિમવામાં આવેલ છે તેમજ ઝોન વાઈજ ડે.હેલ્થ ઓફિસરશ્રી તથા તેમના મદદનીશ તરીકે આસી.હેલ્થ ઓફિસરશ્રી અને સફાઈ કામગીરીનાં સપુરવિઝન માટે સેની.સુપ્રિન્ટેન્ડન્ટશ્રી, વૉર્ડ લેવલે પ.ડે.સુ.તેમજ સેનીટેશન તથા કલોરીનયુક્ત પાણી અને ખાંડી પીણીના ચેકીગની કામગીરી કરવા માટે સેની.ઈન્સપેક્ટર અને સેની. સબ.ઈન્સપેક્ટરની નિમણૂંક કરવામાં આવે છે.

૨. પ્રસ્તાવના

અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશન વિસ્તારની વસ્તી આશરે ૫૫.૬૮ લાખ તથા બહારથી આવતા માઈગ્રન્ટ લોકોને ધ્યાનમાં લેતા અંદાજીત ૬૫ લાખ જેટલી કુલ વસ્તી થાય છે. જેમાં અમદાવાદ શહેરમાં ૩૦૦૦ જેટલી ચાલી અને ઝુંપડપટી (ચાલી જેવા વિસ્તારો) આવેલા છે. ઉપરોક્ત વિસ્તારની વસ્તી અંદાજીત ૩૦ લાખની ઉપર છે. જેના માટે અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશનના આરોગ્ય વિભાગ દ્વારા ૫૭ વોર્ડના શહેરી આરોગ્ય કેન્દ્ર મારફતે વિવિધ સેવાઓ જેવી કે રસીકરણ, જનરલ ઓ.પી.ડી., એન્ટીનેટલ સારવાર, કિશોરીને માર્ગદર્શન, મમતા દિવસની ઉજવણી, જન્મ મરણ, લગ્ન નોંધણી તેમજ રાષ્ટ્રીય કાર્યક્રમો જેવા કે પોલીયો, ટી.બી., એચ.આઈ.વી. એઈડસ, વિટામીન-એ સાખીમેન્ટરીસ તથા એપીડેમીક રોગોનું સર્વેક્ષણ જેમાં પાણીજન્ય રોગો જેવા કે કમળો, ટાઈફોઇન, કોલેરા, ઝાડા ઉલ્ટી અને વાહકજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્યુ, ચિકનગુનીયા કરવામા આવે છે. આમ અમદાવાદ શહેરમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો પ્રવર્તમાન હોઈ, પૂરતી તકેદારીના પગલાંનું અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશનના હેલ્થ અને ઈજનેર વિભાગ દ્વારા સુઆયોજન કરી અને શહેરમાં વસ્તાં નાગરિકો તરફથી પુરતા પ્રમાણમાં તકેદારી લેવામાં આવે તો ઉપરોક્ત રોગચાળાને કાંપુ માં લઈ શકાય તેમ છે.

અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશન વિસ્તારમાં સરકારી અને ભૂનિ.કોપોરિશન સંચાલિત જનરલ હોસ્પિટલમાં સને-૨૦૧૦માં ઝાડા ઉલ્ટીના ૭૬૭૭ કેસ, કમળાના-૩૦૮૧ કેસ, ટાઈફોઇનના- ૭૭૮ કોલેરાના-૧૬૫ નોંધાયેલ હતા, યારે સને-૨૦૧૧માં ઝાડા ઉલ્ટીના ૪૪૭૨ કેસ, કમળાના - ૬૭૦૫ કેસ, ટાઈફોઇનના-૧૩૫૫ કોલેરાના- ૫૭ અને ૨૮ કમળાથી મૃત્યુ નોંધાયેલ છે. જે બાબત દશાવે છે કે, સને-૨૦૧૧માં કમળા અને ટાઈફોઇનના કેસોની સંખ્યામાં બમણાંથી પણ વધારો જોવા મળે છે અને કમળાના કેસો ના મૃત્યુ આંક વધુ છે. આ કમળો પાણીજન્ય હીપેટાઈટીસ-ઈ વાઈરસથી ફેલાય છે. **પાણીજન્ય રોગચાળો થવાનું મુખ્ય કારણ નિભન કક્ષાની રહેણી-કરણી, પીવાના ચોખ્ખા પાણીનો અભાવ તથા ગટર લાઈનની અસુવિધા, ચાલી વિસ્તાર અને ઝુંપડપટીમાં રહેતા લોકો માટે પડકારરૂપ છે તથા આ પાણીજન્ય રોગનું વિષ્ણેષણ કરતાં માલુમ પડે છે કે વધુ કેસો પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ઝોનના કેટલાક વોર્ડ પૂરતા સીમિન રહ્યા છે જેમ કે જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, અમરાઈવાડી, ગોમતીપુર, રાજપુર, ઠક્કરનગર વોર્ડમાં જોવા મળેલ છે. આ ઉપરાંત અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશન દ્વારા ઓગષ્ટ-૨૦૧૧થી પ્રાઈવેટ હોસ્પિટલની માહીતી લેવાનું શરૂ કરવામાં આવેલ છે. પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા અને નવા પશ્ચિમ ઝોનમાં કાળી ગામ અને વેજલપુર વોર્ડમાં **પાણીજન્ય રોગચાળાના** કેસો નોંધાયેલ છે. અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશનની મુખ્ય પાણીની લાઈનમાં ગેરકાયદેસરનું હલકી ગુંણવતાવાળી પી.વી.સી.પાઈપ લાઈનનું કનેક્શન લેવાથી તથા તે વિસ્તારોમાં ગટરનું પાણી ભળી જવાથી રોગચાળો ફેલાય છે. તેથી જો તેમની રહેણી કરણીમાં સુધારો, પીવાનું**

શુધ્ય પાણી, સુયોજ્ઞત ગટર યવસ્થા તથા ચોખ્યું પર્યાવરણ પુરુ પાડવામાં આવે તો, કમળા, જાડા ઉલ્ટી, ટાઈફોઇન, કોલેરાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય તેમ છે. અમુક વિસ્તારોમાં સ્થાનિક કારણોને કારણો ફોકલ આઉટબ્રેક થાય છે જેમાં કમળાના રોગચાળો અવારનવાર જોવામાં આવેલ છે.

૩. પાણીજન્ય રોગચાળાના પ્રકાર અને જવાબદાર કારણો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ૬૪ વૉર્ડ અને ૬ જોનમાં પ્રવ્રતમાન પાણી જન્ય રોગચાળો જેવા કે કમળો, ડાઈફોઇઝ, જાડા ઉલ્ટી અને કોલેરાની માહિતી ત મ્યુનિ. જનરલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, ચેપી રોગ હોસ્પિટલ, બાપુનગર જનરલ હોસ્પિટલ અને ૭૦થી પણ વધુ પ્રાઈવેટ હોસ્પિટલ પાસે પણ રોજેરોજ ૧૨ વાગ્યા સુધીમાં માહિતી એકત્રીત કરી દર્દીના ઘરના સરનામાં મુજબ દરેક જોનને ખ્યાલ રાખી રોગના પ્રકાર મુજબ અને વૉર્ડ પ્રમાણે ઈન્ટરનેટના માધ્યમથી માહિતી મોકલી આપવા આવે છે. જેથી ફિલ્ડ લેવલે જરૂરી રોગ અટકાયતી પગલાં લઈ શકાય. વિવિધ પાણીજન્ય રોગચાળાની માહિતી નીચે મુજબ છે.

૩.૧ કમળાના પ્રકાર અને કમળો થવાના મુખ્ય જવાબદાર કારણો

(૧) પાણીજન્ય કમળો:

પાણીજન્ય કમળો થવાનું મુખ્ય જવાબદાર કારણ હિપેટાઈટીસ-એ અને ઈ છે. મુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા કેટલા વર્ષથી હિપેટાઈટીસ ઈ નો કમળો મોટાભાગે જોવામાં આવેલ છે. આ પ્રકારનો કમળો દૂષિત પાણી અને દૂષિત પાણીમાંથી બનાવેલ ખોરાક લેવાથી થઈ શકે છે. કમળાનો રોગ જે તે વિસ્તારમાં ફેલાય છે, તેથી જો લોકોની રહેણી કરણીમાં સુધારો, પીવાનું શુષ્ઘ પાણી, સુયોજ્ઞત ગટર યવસ્થા તથા ચોખ્યું પર્યાવરણ પુરુ પાડવામાં ન આવવાને કારણે કમળાના કેસોમાં વધારો થવાની શક્યતા વધી જાય છે.

હિપેટાઈટીસ -એ પ્રકારના કમળામાં વાયરસ શરીરમાં પ્રવેશ્યા બાદ ૧૫ થી ૪૫ દિવસના સમયગાળામાં રોગોના ચિહ્નો અને લક્ષણો દેખાય છે. જ્યારે હિપેટાઈટીસ -ઈ પ્રકારના કમળાના વાયરસમાં ૧૫ દિવસથી લઈને ૬૦ દિવસ સુધીમાં રોગના ચિહ્નો અને લક્ષણો દેખાય છે.

(૨) દવાથી થતો કમળો:

આ પ્રકારના કમળામાં કોઈ ચોક્કસ પ્રકારનું યકૃતને નુકસાન કરતી દવા લેવાથી યકૃતનું કામ ખોરવાય છે. જેના કારણે કમળો થાય છે. જેમ કે ટી.બી.ના દર્દીને ચાલતી આઈસોનાઝાઈડ અને રીફામપીશીન નામની સતત ચાલતી દવાને કારણે આ પ્રકારનો કમળો થવાની શક્યતા રહેલી છે તેમજ વધુ પડતો આલ્કોહોલના સેવનથી પણ આ પ્રકારનો કમળો થવાની શક્યતા રહેલી છે.

(૩) લોહીથી થતો કમળો: - -

આ પ્રકારના કમળાનું મુખ્ય કારણ હિપેટાઈટીસ-બી અને હિપેટાઈટીસ-સી વાઈરસ છે. જે અસુરક્ષિત સીરીંજ, સોય વાપરવાથી, લડ ટ્રાન્સમીશન, માતાથી નવજાત શિશુને, યૌન સંબંધથી થાય છે. જેમાં લાંબા ગાળે લીવરનું કેન્સર થવાનું જોખમ રહે છે પરંતુ વૈચક તકેદારી રાખવામાં આવે તો આ પ્રકારના કમળાથી બચી શકાય તેમ છે.

(૪) અન્ય જવાબદાર કારણો:

લીવરની બિમારી જેવી કે પિતાશયની પથરી, પિતાશયના રોગના કારણો અથવા મેલેરીયા જેવા રોગોમાં પણ અથવા તો હીમોફીલીયા અને થેલેસીમીયા જેવા આનુષાંગિક રોગોમાં પણ કમળાનો રોગચાળો જેવા મળે છે.

➤ કમળાના (ચિહ્નો) લક્ષણો અને તે અંગોની લેબોરેટરી તપાસ

કમળો થાય ત્યારે દર્દીને અચાનક ઝીણો તાવ આવે, શરીર તૂટવું, ભૂખ ન લાગવી, ઉલ્ટી ઉ કા થવા, પટેમાં દુખાવો થવો અને આંખો પીળી દેખાવી જેવી ફરીયાદો રહેતી હોય છે. રોગના મુખ્ય લક્ષણોમાં આંખો પીળી દેખાવી, લીવર પર સોજો, પેટમાં દુખાવો તથા પેટ કુલી જવું જેવા લક્ષણો દેખાય છે. જેના અનુસંધાને લેબોરેટરી રીપોર્ટમાં સીરમ બીલીયુરુબીન ૨ મિ.ગ્રા.થી વધી જવું અને એસ.જી.પી.ટી.નું પ્રમાણ ૪૦થી વધવું તથા હિપેટાઈટીસ-એ અને ઈ લેબોરેટરી ટેસ્ટ દ્રારા કનફોર્મ કરીને નિદાન કરી કરી શકાય છે.

૩.૨ ટાઈફોઇડનો તાવ

ટાઈફોઇડનો તાવ મુખ્યત્વે સાલ્મોનેલા ટાયફી અને પેરા ટાયફી એ અને બી દ્રારા થતો રોગ છે અને જેનું માધ્યમ દુષ્પિત પાણી અને દુષ્પિત ખોરાક દ્રારા ફેલાય છે. જે બેકટેરીયાથી થતો રોગ છે. આ બેકટેરીયા શરીરમાં એકવાર પ્રવેશ્યા પછી તેના ૧૦ થી ૧૫ દિવસ પછી તેના ચિહ્નો અને લક્ષણો કન્નીન્યુઅસ હાઈગ્રેડ ફિવરના રૂપમાં દેખાય છે. ટાઈફોઇડ થવા માટે અસરગ્રસ્ત કેસમાં મળ અને મૂત્ર ઉપરાંત ધણા કેરીયર સ્ટેજમાં (જેમાં ટાઈફોઇડના જીવાણું હાજર છે પરતું રોગના લક્ષણો કે ચિહ્નો નથી તેવી યક્તિઓ) ૧.૫ થી ૨ મહિના સુધી મળમૂત્રમાં સાલ્મોનેલા ટાયફીનું ઉત્સર્ગ કરે છે. અને ઉપરાંત ટાયફોઇડના કેસોમાં ૨ થી ૫ ટકા કેસો ધણા વર્ષો સુધી ટાયફોઇડના બેકટેરીયાનું ઉત્સર્ગ વર્ષો સુધી કરતા રહે છે.

➤ ટાઈફોઇડ રોગ થવાનું મુખ્ય કારણ

ટાઈફોઇડ કેસના મળમૂત્રના સંપર્કમાં પ્રદુષિત પાણી , ખોરાક , માખી દ્રારા અને તેમાં પણ હાથ ન ધોવા જેવી સ્વઅષ્ટાનો અભાવ મુખ્ય ભાગ ભજવે છે. ટાઈફોઇડના સૌથી વધુ કેસો જુલાઈ થી સપ્ટેમ્બર મહિનામાં દેખાય છે. કારણ કે વર્ષારૂતું અને માખીઓનો ઉપક્રમ વધારે જોવા મળે છે. ટાઈફોઇડના બેકટેરીયા પાણીમાં ૪૮ કલાકથી વધારે જીવી શકતા

નથી. પરતું ખોરાકની અંદર આસાનીથી રહીને રોગચાળો ફેલાવે છે. તેમાં પણ મુખ્યત્વે દુધ અને દુધની આઈટમો અને વધુમાં શાકભાજી કે જે સુઅેજના પાણીમાંથી ઉગાડવામાં આવે ત્યારે પણ રોગચાળો થવાનો ભય રહે છે.

➤ ટાઈફોઇટ વખતે ચિહ્નનો

ટાઈફોઇટ તાવ આવે ત્યારે શરીર દુખું, માથું દુખું, પેટનો દુખાવો, ગળાની તકલીફ અને કબજ્જ્યાત અને હાઈગ્રેડ ફિવર અને ઝાડા ઉલ્ટી તેના મુખ્યત્વે લક્ષણો છે. જો દર્દીને તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો આંતરડામાં ચાદુ પડે છે વધુમાં આંતરડામાં કાણું પણ પડી શકે છે.

ડ.ડ ઝાડા ઉલ્ટીના કેસો

પ્રસ્તાવના

જો કોઈ યક્કિતને દિવસમાં ઉ કે તેથી વધારે પાણી જેવા મળ પસાર થાય તો તેને ઝાડા થયા છે તેમ કહી શકાય. ઝાડા ઉલ્ટીને કારણે ૫ વર્ષથી નીચેના બાળકોમાં મૃત્યુનું પ્રમાણ સૌથી વધારે જેવા મળે છે. તથા હોસ્પિટલમાં દાખલ થતા બાળકોના વિભાગમાં ઉત્ત % કેસો ઝાડા ઉલ્ટીના કારણે દાખલ થાય છે.

➤ ઝાડા ઉલ્ટી થવાનું મુખ્ય કારણ

- (૧) વાયરસની અંદર મોટાભાગે ૨૨ % થી ૬૬% કિસ્સામાં રોટા વાયરસના ચેપના કારણે ઝાડા ઉલ્ટી થયેલા માલુમ પડે છે.
- (૨) બેકટેરીયાની અંદર મનુષ્યના મળમાં રહેતા ઈ-કોલાઈ ૧૦% થી ૨૦%, કોલેરા ૫% થી ૧૦%, અને સાલ્મોનેલા ૧% થી ૫% કિસ્સામાં ઝાડા ઉલ્ટીના કેસો કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. વધુમાં આંતરડામાં થતા કૂમિ પણ ઝાડા ઉલ્ટી કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.
- (૩) મનુષ્યના વધારે પ્રમાણમાં ઝાડા ઉલ્ટીના કેસો દ મહિનાથી લઈને ૨ વર્ષ સુધીના કિસ્સામાં જેવા મળે છે. કારણો કે તેમને ઉપરનો ખોરાક આપવામાં ચાલુ કરવામાં આવે અને માતાનું ધ્યાવણ ઓછું થાય છે.
- (૪) ઝાડા ઉલ્ટી થવા માટે ઉનાળામાં મુખ્યત્વે બેકટેરીયલ જેવા કે ઈ-કોલાઈ, વીબ્રીયો કોલેરા અને સાલ્મેનેલા જેવા જીવાણું જવાબદાર છે. જ્યારે શિયાળાની રૂતુમાં રોટા વાયરસના વાયરસ મુખ્યત્વે જવાબદાર છે.

➤ જાડા ઉલ્ટી થવા માટેનું માધ્યમ

જાડા ઉલ્ટી થવા માટે મુખ્યત્વે યક્ષિતગત સ્વચ્છતાના અભાવે મનુષ્યના મળમાં રહેલા બેકટેરીયા , વાયરસ, કોલેરા જેવા બેકટેરીયા પાણી અને ખોરાકને પ્રદુષિત કરે છે અને જે બીજી યક્ષિત દ્રારા ઉપયોગમાં લેતા તેમને જાડા ઉલ્ટી થઈ શકે છે. વધુમાં ખુલ્લામાં મળ ત્યાગ જેવી પ્ર ગૃહિતને કારણે પણ અને ચોમાસાની રૂતુ દરમ્યાન માખીના ઉપદ્રવને કારણે પણ વાયરસ અને બેકટેરીયાના વહન માટે મુખ્ય જવાબદાર વાહક છે. જાડા ઉલ્ટીની સારવાર મુખ્યત્વે ઓ.આર.એસ.નું દ્રાવણ અને ડોક્ટરની સલાહ મુજબની દવા લેવામાં આવે તો મૃત્યુદર ઘટાડી શકાય તેમ છે.

➤ સમયગાળો

કોલેરા જેવા રોગોમાં સમયગાળો થોડા કલાકથી લઈને ૫ દિવસનો હોય છે. અને જેમા સમયસર સારવાર અને ફલુડ થેરાપી મળવી અતિ આવશ્યક છે.

૩.૪ ખોરાકી ઝેરની અસર

રોજીંદા ઉપયોગમાં લેવામાં આવતો ખોરાક જેવા કે પ્રવાહી ખોરાક કે દુધની વસ્તુઓમાં કયારેક અક્સમાતે બહારથી બેકટેરીયા ભણી જવાથી અને આવો બેકટેરીયાયુક્ત ખોરાક મનુષ્યના શરીરમાં જવાથી તેની અસરો જાડા ઉલ્ટીથી માંડી મૃત્યુ સુધી જેવા મળે છે. જેને ખોરાકી ઝેરની અસરો ગણવામાં આવે છે.

➤ સમયગાળો

ખોરાકી ઝેરની અસરોનું મુખ્યત્વે સમયગાળો એપ્રિલથી લઈને જુન સુધી અને દુધની બનાવટમાં આખા વર્ષ દરમ્યાન ગમે ત્યારે થઈ શકે છે.

અમદાવાદ ચ્યુનિ.ક્રોપોરિશનમાં છેલ્લા વર્ષમાં બે કુડ પોઈઝનીંગના કિસ્સા નોંધાયેલા હતા જેમા ખોરાક ખાવાના દુકાની અંદર તેને આરોગનાર તમામ યક્ષિતાઓને જાડા ઉલ્ટીની અસર જણાય હતી. જેનું મુખ્યત્વે કારણ સ્ટેફાયલો કોક્સ કુડ પોઈઝનીંગ જેવા મળેલ હતું જે મુખ્યત્વે સલાહ, દઢી, અને દુધની આઈટમોમાં ઉપયોગમાં લેવાથી વધારે પ્રમાણમાં જોવા મળે છે.

અખાધ માસ, દુધ અને ઈડાંની વસ્તુઓ ખાવાથી સાલ્મોનેલા કુડ પોઈઝનીંગ થઈ શકે છે. જેનો સમયગાળો ખોરાક ખાધા પછી ચિહ્નનો દેખાવાનો સમયગાળો ૧૨ થી ૨૪ કલાકનો હોય છે.

➤ ફુડ પોઇન્ટ્સનીંગ થવાના કારણો

યકૃતગત સ્વચ્છતાના અભાવે, ખોરાક અને પાણીમાં બેકટેરીયા ભળવાથી તથા માખીના ઉપદ્રવને કારણો અને વાતાવરણના તાપમાન અને ભેજની અસરોને કારણો બેકટેરીયા ખોરાકમાં ગૃધ્ય થવા પામે છે. અને તેના દ્વારા ચોક્કસ પ્રકારનો રસાયણો ખોરાકમાં ઉત્પન્ન થવાથી આવો ખોરાક ઉપયોગમાં લેવાથી.

૪ અ.મ્યુ.કો.વિસ્તારમાં નોંધાયેલ પાણીજન્ય રોગચાળાના કેસો બાબત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાતા પાણીજન્ય રોગચાળાના કેસો થવા માટે મુખ્યત્વે નીચેના પરિબળો જવાબદાર હોય છે.

(૪.૧) પાણીની પાઈપ લાઈનમાં લીકેજ્લ્સ:

- પીવાની પાઈપ લાઈનમાં લીકેજ્લ્સ થવાના મુખ્ય કારણો:

- (૧) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાણીનો સમય આખા વર્ષ દરમ્યાન એક જ ટાઈમનો રહ્યો છે. જેમાં પણ પાણીનો સપ્લાય આખા દિવસમાં એક કલાકથી માંડીને બે કલાક આપવામાં આવે છે. તે સિવાયના સમય દરમ્યાન નેગેટીવ સક્ષણના કારણે, યાં પાણીની પાઈપ લાઈનના સાંધામાં નબળાઈ હોય ત્યારે આવા કિસ્સામાં આજુબાજુમાં જમીનમાંથી ગટરનું પાણી પીવાના પાણીમાં ભણે છે. જે નીચાણવાળી પાઈપલાઈનમાં સંગ્રહેલું પડ્યુ રહે છે. યારે બીજા દિવસે પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવે છે ત્યારે સંગ્રહેલું પ્રદૂષિત પાણી ઘરો સુધી પહોંચે છે અને આવું પાણી પીવાથી પાણીજન્ય રોગચાળો થવાની શક્યતા વધી છે.
- (૨) અમુક સોસાયટીઓ અને ચાલીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય પાણીની પાઈપ લાઈન તોડીને તેમાંથી ગેરકાયદેસર પાણીના કનેક્શનો મેળવીને પાણીનો સપ્લાય મેળવે છે. જેથી પાણીની તૂટેલી પાઈપ લાઈન અને ગટર લાઈન ભેગી થવાને કારણે પાણીજન્ય રોગચાળો થવાની શક્યતા રહે છે.
- (૩) ટેલીફોન કંપની, ગેસ કંપની, અથવા વિજળીની સર્વિસ લાઈનો નાંખવા અને રીપેરીંગ કામ માટે, ખોદકામ દરમ્યાન સોસાયટી કે ચાલી દ્વારા લેવામાં આવેલ પાણીના કનેક્શનો તુટવાના કારણે ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થવાથી રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે.
- (૪) પ્રોજેક્ટના કામો દરમ્યાન જેવા કે રોડ, રસ્તા અને બ્રીજ અને બી.આર.ટી.એસ. ના કામ માટે જ્યારે રોડ ખોદવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરના મશીનો દ્વારા તે રોડમાં આવતી તમામ પાણીની લાઈનો અને ગટર લાઈનોને નુકશાન થવાના કારણે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે.
- (૫) ઘણા વિસ્તારોમાં પીવાના પાણીનો સપ્લાય પુરતા પ્રેશરના અભાવે ઘરમાં કુંડી બનાવવામાં આવે છે તથા આ કુંડી કપડા ધોવા અને વાસણ ધોવામાં ઉપયોગમાં લેવામાં આવતી ચોક્કીની પાસે જ બનાવવામાં આવે છે. જેના કારણે ઘર વપરાશનું ગંદુ પાણી આવી કુંડીમાં જવાથી અને આ કુંડીમાં પાણીના નળનું લેવલ ખુબ જ નીચુ હોવાથી પાણીનો સપ્લાય બંધ હોય ત્યારે પાણીમાં ગટરનું ગંદુ પાણી મિક્સ થવાની શક્યતા રહે છે.

- (૬) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હાઉસીંગના મકાનો કે અન્ય વસાહતો ૧૫ કે તેથી વધુ વર્ષો જુની છે તેમાં પાણીની પાઈપ લાઈનો કાટખાઈ ગયેલ હોવાથી તથા પાણી અને ગટર લાઈનો ઉપર ગેરકાયદેસર દબાંશ થવાથી યોગ્ય મરામત કરી શકતી નથી. જેના કારણે પીવાના પાણીની લાઈન પ્રદૂષિત થાય છે.
- (૭) પીવાના પાણીના લો પ્રેસરના કારણે અમુક વિસ્તારોમાં ગેરકાયદેસર મોટરીંગ કરવામાં આવે છે જેના કારણે પાણીની લાઈનમાં નેગેટીવ પ્રેસર ઉત્પન્ન થવાથી આજુબાજુનું ગટરનું પાણી, પીવાના પાણીમાં મિક્સ થાય છે.
- (૮) મોટાભાગની સોસાયટીઓ દ્વારા કોર્પોરેશનની પાણીની લાઈનમાંથી પાણીનો સપ્લાય લેતી વખતે પી.વી.સી પાઈપ લાઈનનો ઉપયોગ કરતા હોવાથી કાસ્ટીંગ પાઈપ અને પી.વી.સી.ની પાઈપ લાઈનના જોડાંશ બરાબર ન થવાથી લીકેજસની શક્યતા રહે છે. જેમાં પીવાનું પાણી સાથે ગટરનું પાણી ભળતા પાણી પ્રદૂષિત થાય છે.

(૪.૨) ગટર લાઈન ઉભરાવવી :-

- (૧) ગટર લાઈનો અને તેના ચેમ્બર સમયાંતરે ડિસીલ્ટ ન થવાથી ચોકઅપના કારણે ગટર લાઈન ઉભરાય છે. જે આજુબાજુમાં આવેલ પાણીના લીકેજસમાં ગટરનું પાણી ભળવાથી પીવાનું પાણી પ્રદૂષિત થાય છે.
- (૨) ગટરની લાઈનો પ્રોજેક્ટ દ્વારા કે જોન દ્વારા નાખવામાં આવે છે ત્યારે કોન્ટ્રોકટર દ્વારા બે પાઈપો વચ્ચેના સાંધા બરાબર સીમેન્ટથી ફીટ ન કરવાના કારણે ગટરના લીકેજસથી નજીકમાં પાણીની પાઈપ લાઈન પસાર થતી હોયતો પીવાનું પાણી પ્રદૂષિત થાય છે.
- (૩) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક વિસ્તારોમાં જેવા કે ચાલી કે જુપડપડીમાં અંદરના રસ્તાઓમાં દબાંશ થવાથી ગટર લાઈનની મેઈન ચેમ્બર પાણીની લાઈનની એકદમ નજીક બનાવવામાં આવે છે. કે જેમાં અમુક જગ્યાએ પીવાના પાણીની લાઈન ગટરની ચેમ્બરમાંથી પસાર થવાથી પાણીની લાઈન લીકેજ થવાની શક્યતા રહે છે. જેથી પાણી પ્રદૂષિત થાય છે.
- (૪) સાંકડી ગલીઓમાં પાણીની લાઈનો અને ગટર લાઈનો નજીકના અંતરમાં આવેલી હોવાથી ગટર અને પીવાના પાણીની લાઈનો ભેગી થવાથી રોગચાળો ફેલાવાની શક્યતા રહેલી છે. અગાઉના સમયગાળામાં પાણીના લીકેજસનું રીપેરીંગ સાયકલના રબર ટયુબથી કરવામાં આવતું હતું અને યારે લાકડાના ટુકડાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પાણીનું કનેક્શન બંધ કરવામાં આવતું હતું. જેથી પાણીના લીકેજસનું આ પધ્યતિથી યોગ્ય રીતે રીપેરીંગ થતું ન હોવાથી રબર તથા લાકડાનો ટુકડો સડી જવાથી તે જગ્યાએ પાણીમાં પ્રદૂષણ થવાની શક્યતા રહે છે. જેથી પાણીના

આવા લીકેજ્સ યવસ્થિત રીતે બંધ કરાવવા અને જરૂર પડે તો પાણીની લાઈનો બદલવા માટેની યોગ્ય યવસ્થા કરવાની જરૂર છે.

- (પ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અમુક વસ્તારોમાં ટી.પી.ફાઈનલ ન થવાથી ગટર લાઈન નાખી શકાયેલ નથી અથવા તો ગટર લાઈન નાખી દીધેલ છે પરંતુ ડ્રેનેજ પંખીંગ સ્ટેશન બનાવેલ નથી જેના કારણે તે વિસ્તારમાં રહેતા નાગરીકો દ્વારા અને તેમની સોસાયટી કે ચાલી દ્વારા ખુલ્લામાં ગટરનું પાણી છોડવામાં આવે છે. જેમા નજીકીયી પસાર થતી પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળવાથી પાણી પ્રદૂષિત થાય છે.
- (૬) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પૂર્વના પણ્ણાના વિસ્તારોમાં સોસાયટીના મકાનો રોડ લાઈનથી નીચા હોવાને કારણે મુખ્ય રક્ષાની ગટર લાઈન બેક મારતી હોય તો સોસાયટીની ગટર લાઈનમાં ગટરનું પાણી ઘરમાં અથવા ચોકીમાં અથવા ચોકીમાં બનાવેલ કુંડીમાં પીવાના પાણી સાથે મિક્સ થવાની શક્યતા રહે છે.
- (૭) ચોમાસાની સિઝનમાં સ્ટોર્મ વોટર લાઈનનો અભાવ અથવા તો નીચાણવાળા વિસ્તારમાં ચોમાસાનું પાણી મુખ્ય ગટરમાં વહેતુ હોય છે જેના કારણે ગટરો બેક મારે છે ત્યારે પાણી પ્રદૂષિત થવાની શક્યતા રહે છે. ચોમાસા પહેલા યવસ્થિત રીતે ડીસીલ્વીંગની કામગીરી કરવાની જરૂર છે.
- (૮) અમદાવાદના અમુક રક્ષાઓ ચોમાસાની સિઝન દરમ્યાન રોડ વચ્ચે ભુવા પડવાથી રોડની વચ્ચેથી પસાર થતી ગટર લાઈન ચોકઅપ થાય છે. જેના કારણે તેના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીની લાઈન અને ગટર લાઈન મિક્સ થાય છે.

(૪.૩) ખાળકુવા સુવિધા (ડ્રેઇન અસુવિધા) :-

(૧) ગટર લાઈન ડીસીલ્વીંગની અંગોની કામગીરી:

શહેરના અમુક વિસ્તારોમાં કાયમી ડ્રેનેજ ઉભરાવાની ફરીયાદ રહેતી હોય છે. અગાઉ મેનહોલ સાફ કરવાની પદ્ધતિમાં ફેરફાર થવાથી મેનહોલ થી મેનહોલ સુધીની લાઈન સાફ થઈ શકતા નથી. દરેક જોનમાં આવેલ હાઈરીસ્ક વિસ્તારમાં પ્રિવેન્ટીવ પગલા તરીકે નિયમિત રીતે ડીસીલ્વીંગ કરાવવાની જરૂર છે.આવા વિસ્તારમાં યારે મેનહોલ ઉભરાય ત્યારે તે વિસ્તારમાં ગંદુ અને વાસ મારતું પાણી આવવાની ફરીયાદ જોવા મળે છે. જેનું મુખ્ય કારણ પાણીની લાઈન અને ડ્રેનેજ લાઈન ભેગી થવાથી આ પ્ર ઉદભવે છે. આવા વિસ્તારમાં ગટર લાઈનની નજીકમાં આવેલ પાણીની લાઈનો ચેક કરી બદલવાની જરૂર છે.

- (૨) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઔડા વિસ્તારમાંથી નવા સમાવેલા વિસ્તારો જેવા કે નિકોલ, વસ્ત્રાલ, રામોલ, લાંબા, નવા પશ્ચિમ ઝોનનો અમુક ભાગ તથા દક્ષિણ ઝોનના બોંબે હોટલ નારોલનો આસપાસનો વિસ્તાર કે જેમા ઔડા દ્વારા સોસાયટીના ખાલ ખાળું વાન ખાળું વાન આધારે કરવામાં આવે છે. તથા વટવાના બીબી તળાવના આસપાસના વિસ્તારમાં ગટર લાઈનના અભાવે ખાળું વાન હાલની તારીખે ઉપયોગમાં લેવામાં આવે છે. પાણીની લાઈન કોર્પોરેશન દ્વારા સપ્લાય ન કરવામાં આવતું હોય ત્યારે સોસાયટી, ચાલીના આવાસમાં પાણીના શેલોબોર બનાવવામાં આવે છે. જેમા ખાળું પાણી જમીનનાં ઉપરના તળમાં સચવાયેલ પાણીમાં પાણી મિક્સ થવાથી પાણીજન્ય રોગ થવાની શક્યતા રહે છે.
- (૩) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરી વિસ્તારમાં હોવાથી રહેવા માટે જગ્યાનો અભાવ રહે છે. જેના કારણે ખાળું વધાવતા વિસ્તારમાં ઘર દીઠ એક ખાળું વધાવતી લઈ ને ચાર ઘર વચ્ચે એક ખાળું વધાવતી બનાવવામાં આવે છે. જેથી ખાળું આયુષ્ય વપરાશ વધવાથી ઘટી જવા પામે છે. તેવી પરિસ્થિતિમાં જગ્યા ન હોવાથી બીજો ખાળું બનાવવાની શક્યતા નથી. અને ગટરનું પાણી ખુલ્લામાં વહે છે જે પીવાના પાણી સાથે મિક્સ થતા પાણી પ્રદૂષિત થાય છે.
- (૪) ખાળું બનાવવાની ચોક્કસ પદ્ધતિ અને જગ્યા નક્કી કરવાની હોય છે. જેમા ઘણી જગ્યાએ ખાળું મકાનની પાછળની જગ્યાએ બનાવવામાં આવે છે. જ્યારે ખાળું ઉભરાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાળું ખાલી કરવાની ગાડી જગ્યાના અભાવે ખાળું સુધી પહોંચી શકતી નથી. જેના કારણે ખાળું પાણી બધાર આવે છે.
- (૫) અમુક વિસ્તારોમાં ખાસ કરીને કોર્પોરેશનમાં સમાવેશ થયેલ વિસ્તારમાં આવેલ રહેઠાણના મકાનોના ખાળું નિયમ મુજબ બનાવવા આવેલ નથી. જેના કારણે પ લીક તરફથી ફરીયાદો વધુ પ્રમાણમાં નોંધવામાં આવે છે. ખાસ કરીને ચોમાસામાં આ પ્ર વિકટ બને છે. આવા વિસ્તારમાં ડ્રેનેજ લાઈનને નાખવાની કામગીરીને અગ્રીમતા આપવા અને જરૂર જણાય તો વધુ ખાળું ખાલીઓનું આયોજન કરવાનું થાય છે.

(૪.૪) પ્રાઈવેટ બોર્ડ:-

- (૧) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ગેર કાયદેસર સોસાયટીમાં અથવા કાયદેસરની સોસાયટી કે જ્યા પાણીનું લો પ્રેસર રહેવાને કારણે પાણીનો પુરતો જથ્થો મળતો નથી તેવા કિસ્સાઓમા પ્રાઈવેટ સોસાયટી દ્વારા પોતાનો બોર બનાવવામાં આવે છે. પરંતુ આવા પ્રાઈવેટ બોર ઉપર કલોરીન ડોઝર ન હોવાને કારણે કલોરીનેશન કરી શકતું નથી. જેના કારણે પ્રદૂષિત પાણી ભળતું હોય તો પીવાના પાણીમાં વાયરસ સામે રક્ષણ મળી શકતું નથી.
- (૨) ઉપરોક્ત કિસ્સાઓમાં બોરનું પાણી તેમના અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં સંશોધ કરવામાં આવે છે. પછી ત્યાંથી ઓવર હેડ ટાંકી કે ધરેધરે પહોંચતું કરવામાં આવે છે. આ કિસ્સાઓમા અંડર ગ્રાઉન્ડ ટાંકી ઈટોથી બનાવેલ હોવાને કારણે તથા ગટરનું પાણી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ભળવાની શક્યતા રહે છે. આવા કિસ્સાઓમા કલોરીનેશન ન થવાને કારણે રોગચાળો થવાની શક્યતા ખુબ જ રહે છે.
- (૩) ઘણી સોસાયટી, ચાલીના આવાસોમાં પાણીનો સપ્લાય શેલોબોર દ્વારા કરવામાં આવે છે. જેમા આવા વિસ્તારોમાં ગટરની સુવિધા ન હોવાથી ખાળકુવામાં ગટરનું પાણી ભેગુ કરવામાં આવે છે. જેના કારણે ખાળકુવાનું પાણી શેલોબોરના પાણીમાં ભળતા રોગચાળો થવાની શક્યતા વધી જાય છે.

(૪.૫) કલોરીનેશન:-

- (૧) રોગચાળો થતો અટકાવવામાં પાણી થતું કલોરીનેશન ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વોટર પંખીંગ સ્ટેશન ઉપર કલોરીન ગેસથી અને કોર્પોરેશનના બોર ઉપર કલોરીન દ્વાવણીથી કલોરીનેશન કરવામાં આવે છે. પાણીમાં ભળતી કોઈ પણ પ્રકારની અશુદ્ધિ દા.તા. ગટરનું પાણીથી પાણીમાં ભળેલું કલોરીનેશન ઓછુ થવા લાગે છે. તેથી કલોરીનેશન થવા માટે પાણીમાં અશુદ્ધિ ન હોવી જોઈએ પરંતુ વિસ્તારમાં ઉપરોક્ત કારણોમાં બતા યુ તેમ ગટર ઉભરાવી, પી.વી.સી. પાઈપ લાઇન, ગેરકાયદેસર કનેક્શન, ખાળકુવાનો ઉપયોગ, શેલોબોર, ખોદકામ પ્રોજેક્ટના કામોના કારણે જેવા વિવિધ કારણોને કારણે પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી

ભળવાથી પીવાના પાણીમાં કલોરીનેશનની માત્રા ઓછી થાય છે. જેથી પાણીમાં ભળેલા બેકટેરીયા અને વાયરસ સંપૂર્ણ નાશ થઈ શકતો નથી.

- (૨) પ્રાઇવેટ સોસાયટીમાં પોતાના બોર ઉપર કલોરીનેશન માટે તથા અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં કલોરીનનું દ્વાવણ નાખવા માટે કોઈ પણ પ્રકારની યવસ્થા કરવામાં આવેલ હોતી નથી. જેના કારણે પીવાના પાણીમાં કલોરીનેશન થતું નથી.
- (૩) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર ઉપર ધણીવાર લીચ ડોઝરમાં ખામી, કલોરીન દ્વાવણ ખલાસ થિયું, કલોરીન દ્વાવણ લાવવા માટે વાહનની યવસ્થા ન હોવી અથવા કોમ્યુનીકેશન ગેપ(માહિતીના આપ લેના અભાવ)ના કારણે કલોરીનેશન યોગ્ય પ્રમાણમાં થતું નથી જેના કારણે વિસ્તારમાં કલોરીન વગરનું પાણી સપ્લાય થાય છે.

(૪.૬) ખાણીપીણામાં સેનીટેશન:-

અમદાવાદ શહેરના બહારના ખાણીપીણીના ધંધા ઉપર વેચાતા ખાદ્ય પદાર્થો ,ઠંડાપીણા વગેરેનો ઉપયોગ જોતા ખાણીપીણી બજારમાં આરોગ્યના નિયમોનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે.

- (૧) હોટલ-રેસ્ટોરન્ટમાં ખાણીપીણી બનાવતા તમામ રસોયાનું નિયત સમય અંતરે હેલ્થ ચેકઅપ થિયું જરૂરી છે. તેમના રસોડાની જગ્યાઓ પણ ચોખ્ખાઈની દ્વારા સારી હોવી જોઈએ. અનાજ સંગ્રહ કરવાની જગ્યા તથા અન્ય ખાવાપીવાની વસ્તુઓ યવસ્થિત જગ્યાએ જમીનથી ઉપરના ભાગમાં, હવાચુસ ઢાંકણમાં બંધ હોય, રસોઈ બનાવતી વખતે તમામ ચોખ્ખાઈના નિયમો જેવા કે સાફ વાસણો, ધોયેલા હાથ, શાકભાજ અને ફળોને ચોખ્ખા પાણીથી ધોવા, જરૂરી એપ્રન, કેપ અને માલ્ઝ પહેરેલા હોવા જોઈએ તથા રોડન્ટ કીલર અને માખી, મર્ખરો અને અન્ય જીવાતનો ઉપદ્રવ ન થયેલો હોવો જોઈએ. કચરાનો યોગ્ય વૈજ્ઞાનિક પધ્યતિથી નિકાલ થતો હોવો જોઈએ. તથા ચોખ્ખા પાણી યવસ્થા હોવી જોઈએ.
- (૨) લારી ગલ્વા પર વેચાતા ખાદ્ય પદાર્થોમાં સ્વાસ્થ્યના નિયમોનું નીચેના કારણોસર પાલન થતું નથી.


- ખાદ્ય વાનગી વેચાતા યક્કિતનું ભણતર ઓછુ હોવાથી ચોખ્ખાઈ રાખવાની સમજ હોતી નથી.
- માલ્ઝ, એપ્રન, કેપ, ગલોઝ વગેરે જેવી વસ્તુઓ પહેર્યા વગર રસોઈ બનાવી ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા હોય છે.

- લારી ગલ્લાવાળા ખુલ્લામાં બેસતા હોવાથી આજુબાજુનો કચરો-ધૂળ પણ ખાવાની વસ્તુમાં પડવાની શક્યતા રહેલી હોય છે.
- ખાવાની કાચી સામગ્રી જેવી કે ફળો, શાકભાજી પણ ઉત્તરતી કક્ષાના વાપરવામાં આવે છે. જેથી સસ્તુ બનાવીને વેચી શકાય.
- ખાદ્ય પદાર્થના કચરાનો યોગ્ય નિકાલની પણ યવસ્થા હોતી નથી જેના કારણે ખાવાનું બનાવવાની જગ્યાએ કચરો એકઠો થયેલ જોવા મળે છે.
- વધુમાં આવા ધંધા કરતા લોકો ચાલી, જુપડપડીના વિસ્તારમાંથી આવે છે. જ્યા પહેલેથી જ ગંદુ પાણી, ગટર ઉભરાવવી, માખીઓનો ઉપદ્રવ જેવી મુશ્કેલી ઉપસ્થિત હોય છે. જે પાણી લારી ગલ્લાવાળા ખાવાનું બનાવવામાં ઉપયોગમાં લે છે. જેના કારણે રોગચાળો ફેલાવવાની શક્યતા રહે છે.
- લારી ગલ્લાવાળા પાસે ટોયલેટની સુવિધાનો અભાવ અને સ્વચ્છ પાણીના અભાવને કારણે પણ ખાવાની ચીજો બનાવતી વખતે પણ રોગયુક્ત જીવાણું પણ ખાવાની વસ્તુમાં ભણવાની શક્યતા રહે છે.
- બરફના ગોળાવાળા, શેરરીના સંચાવાળા તથા જયુસ સેન્ટરો બજારમાંથી મળતા બીન આરોગ્યપ્રદ બરફનો ઉપયોગ કરે છે. વધુમાં આ બરફ બનાવવાની પદ્ધતિ પણ બીન આરોગ્યપ્રદ અને તેમાં વપરાતુ પાણી પણ બીન આરોગ્યપ્રદ હોય છે. આ બરફને સાચવવો, અન્ય જગ્યાએ વહન કરવો અને સંગ્રહ ખુલ્લામાં કરવામાં આવતો હોઈ વાતાવરણમાં ઉડતો કચરો-ધૂળ તથા જમીનમાં રહેલા જીવાણું પણ બરફમાં ભણતા હોય છે. બરફમાં વપરાતુ પાણી ફેક્ટરી દ્વારા પોતાના પ્રાઈવેટ શેલોબોરમાંથી બેચીને બનાવવામાં આવતો હોય છે. જેથી તેમાં બેકટેરીયોલોઝિકલ અશુષ્ટિ ભણેલી હોવાના કારણે આવા બરફનો ઉપયોગ કરવાથી રોગચાળાની શક્યતાઓ રહેલી છે.

પુન:


પ.૧ અ.મ્યુ.કો. વિસ્તારમાં નોંધાયેલા કમળાના કેસોના છેલ્લા ૧૦ વર્ષના આંકડા

૨૦૦૨	૨૦૦૩	૨૦૦૪	૨૦૦૫	૨૦૦૬	૨૦૦૭	૨૦૦૮	૨૦૦૯	૨૦૧૦	૨૦૧૧
૧૫૮૮	૭૮૨	૧૭૬૭	૬૪૨૧	૪૨૪૬	૧૬૮૦	૨૨૬૬	૩૪૨૭	૩૦૯૧	૬૭૦૫



પ.૨ અ.મ્યુ.કો. વિસ્તારમાં નોંધાયેલા ટાઈફોઇડના કેસોના છેલ્લા ૧૦ વર્ષના આંકડા


૨૦૦૨	૨૦૦૩	૨૦૦૪	૨૦૦૫	૨૦૦૬	૨૦૦૭	૨૦૦૮	૨૦૦૯	૨૦૧૦	૨૦૧૧
૩૫૦	૪૫૪	૪૮૩	૩૪૨	૩૩૭	૫૮૫	૫૮૭	૬૦૦	૭૭૮	૧૩૫૫



પ.ડ અ.મ્યુ.કો. વિસ્તારમાં નોંધાયેલા ઝડા ઉલ્ટીના કેસોના છેલ્લા 10 વર્ષના આંકડા


૨૦૦૨	૨૦૦૩	૨૦૦૪	૨૦૦૫	૨૦૦૬	૨૦૦૭	૨૦૦૮	૨૦૦૯	૨૦૧૦	૨૦૧૧
૩૦૯૭	૩૨૯૮	૩૨૬૬	૩૩૪૨	૩૯૯૪	૫૬૨૪	૪૪૪૯	૬૦૨૪	૭૬૭૩	૪૪૭૨

AGE cases Yearwise Distribution



પ.૪ અ.મ્યુ.કો. વિસ્તારમાં નોંધાયેલા કોલેરાના કેસોના છેલ્લા ૧૦ વર્ષના આંકડા

૨૦૦૨	૨૦૦૩	૨૦૦૪	૨૦૦૫	૨૦૦૬	૨૦૦૭	૨૦૦૮	૨૦૦૯	૨૦૧૦	૨૦૧૧
૨	૧૭	૬	૦	૪	૩૬	૧૪	૭૦	૧૬૫	૫૭




દિન:

૬.૧ કુમળાના માસ વાર્ષિક છેલ્લા બે વર્ષોના આંકડા


નં.	માસ	૨૦૧૦	૨૦૧૧
૧	જાન્યુઆરી	૧૭૫	૪૧૮
૨	ફેબ્રુઆરી	૧૪૮	૪૮૧
૩	માર્ચ	૨૫૧	૭૭૯
૪	એપ્રિલ	૩૪૦	૮૭૧
૫	મે	૨૭૯	૮૧૪
૬	જૂન	૨૬૩	૮૪૭
૭	જુલાઈ	૩૨૧	૭૦૨
૮	ઓગષ્ટ	૨૩૩	૩૮૩
૯	સપ્ટેમ્બર	૨૮૬	૪૨૮
૧૦	ઓક્ટોબર	૨૮૩	૪૦૪
૧૧	નવેમ્બર	૨૨૭	૩૩૩
૧૨	ડિસેમ્બર	૨૭૫	૨૧૪
	કુલ	૩૦૮૧	૬૭૦૪

Jaundice cases Monthwise Distribution




૬.૨ ટાઈફોઇડના માસ વાઈજ છેલ્લા બે વર્ષોના આંકડા

નં.	માસ	૨૦૧૦	૨૦૧૧
૧	જાન્યુઆરી	૨૮	૮૮
૨	ફેબ્રુઆરી	૪૧	૬૧
૩	માર્ચ	૭૯	૧૪૫
૪	એપ્રિલ	૮૨	૧૨૫
૫	મે	૪૬	૧૧૦
૬	જુન	૪૮	૧૦૭
૭	જુલાઈ	૬૮	૬૮
૮	ઓગષ્ટ	૬૬	૧૧૮
૯	સપ્ટેમ્બર	૮૫	૧૭૫
૧૦	ઓક્ટોબર	૬૫	૧૩૨
૧૧	નવેમ્બર	૬૫	૬૭
૧૨	ડિસેમ્બર	૮૨	૬૮
	કુલ	૭૭૮	૧૩૫૫




૬. ક ઝડા ઉલ્ટીના માસ વાઈજ છેલ્લા બે વર્ષોના આંકડા

નં.	માસ	૨૦૧૦	૨૦૧૧
૧	જાન્યુઆરી	૨૩૮	૨૨૬
૨	ફેબ્રુઆરી	૩૩૩	૨૭૬
૩	માર્ચે	૭૪૩	૩૩૭
૪	એપ્રિલ	૧૦૩૮	૩૭૭
૫	મે	૧૨૪૬	૫૬૪
૬	જુન	૧૦૬૬	૫૧૬
૭	જુલાઈ	૮૨૩	૪૭૬
૮	ઓગષ્ટ	૭૨૫	૪૮૮
૯	સપ્ટેમ્બર	૪૨૬	૩૩૨
૧૦	ઓક્ટોબર	૩૦૫	૧૭૩
૧૧	નવેમ્બર	૪૨૮	૪૧૮
૧૨	ડિસેમ્બર	૨૬૦	૨૮૭
	કુલ	૭૬૭૩	૪૪૭૨



૬.૪ કોલેરાના માસ વાઈજ છેલ્લા બે વર્ષોના આંકડા

નં.	માસ	૨૦૧૦	૨૦૧૧
૧	જાન્યુઆરી	૧	૦
૨	ફેબ્રુઆરી	૧	૧
૩	માર્ચે	૧૭	૨
૪	એપ્રિલ	૪૦	૫
૫	મે	૩૭	૧૫
૬	જુન	૨૪	૨૦
૭	જુલાઈ	૧૬	૭
૮	ઓગષ્ટ	૨૪	૫
૯	સપ્ટેમ્બર	૫	૨
૧૦	ઓક્ટોબર	૦	૦
૧૧	નવેમ્બર	૦	૦
૧૨	ડિસેમ્બર	૦	૦
	કુલ	૧૬૫	૫૭



૭ રોગવાઈજ વર્ષવાઈજ આઉટબ્રેક થવાનો સમયગાળો


ઉપરોક્ત ગ્રાફિકલ માહિતી જોતા વિવિધ પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસો કોષ્ટકમાં દર્શા યા માસ વાઈજ જોવા મળે છે.

ક્રમ	રોગનું નામ	રોગચાળો થવાનો સમયગાળો
૧	કુમળો	માર્યથી લઈને જુલાઈ મહિના સુધી
૨	ટાઈફોઇડ	માર્યથી લઈને સાટેમ્બર મહિના સુધી
૩	ઝડા ઉલ્ટી	માર્યથી લઈને ઓગષ્ટ મહિના સુધી
૪	કોલેરા	એપ્રિલથી લઈને ઓગષ્ટ મહિના સુધી

૬:

૮.૧ કમળાના કેસોનું ઓન વાર્ડ્ઝ પત્રક


નં	ઓનનું નામ	૨૦૧૦				૨૦૧૧			
		ઇન્ડોર	ઓ.પી.ડી.	કુલ	%	ઇન્ડોર	ઓ.પી.ડી.	કુલ	%
૧	મધ્ય ઓન	૩૨૮	૮૩૧	૧૧૫૯	૩૭.૫	૭૦૭	૧૧૭૪	૧૮૮૧	૨૮.૧
૨	પર્યાય ઓન	૫૬	૨૭	૮૩	૨.૭	૧૩૪	૫૨	૧૮૭	૨.૮
૩	નવા પર્યાય ઓન	૮૩	૧૬૦	૨૪૩	૭.૬	૧૮૪	૨૭૭	૪૬૧	૬.૬
૪	ઉત્તર ઓન	૧૫૯	૧૬	૨૭૫	૭.૦	૪૦૬	૨૩	૫૨૯	૭.૫
૫	પૂર્વ ઓન	૨૭૫	૭૮	૩૪૩	૧૧.૪	૭૮૬	૧૪૦	૮૩૬	૧૪.૦
૬	દક્ષિણ ઓન	૨૮૫	૭૪૩	૧૦૩૮	૩૩.૬	૮૬૮	૧૮૪૨	૨૭૧૧	૪૦.૪
	કુલ	૧૨૩૬	૧૮૪૫	૩૦૮૧	૧૦૦.૦	૩૧૮૭	૩૪૧૮	૬૭૦૪	૧૦૦.૦



૮.૨ ટાઇફોઇડના કેસોનું ઝોન વાઈજ પત્રક

નં	ઝોનનું નામ	૨૦૧૦		૨૦૧૧	
		કુલ	%	કુલ	%
૧	મધ્ય ઝોન	૭૮	૧૦.૨	૧૮૫	૧૩.૭
૨	પર્ચિ મ ઝોન	૩૭	૪.૮	૧૧૮	૮.૭
૩	નવા પર્ચિ મ ઝોન	૩૨	૪.૧	૧૩૬	૧૦.૦
૪	ઉત્તર ઝોન	૧૬૭	૨૧.૪	૨૪૬	૧૮.૨
૫	પૂર્વ ઝોન	૩૧૮	૪૦.૬	૪૧૫	૩૦.૬
૬	દક્ષિણ ઝોન	૧૪૫	૧૮.૬	૨૫૫	૧૮.૮
	કુલ	૭૭૮	૧૦૦.૦	૧૩૫૫	૧૦૦.૦


Typhoid cases Zonewise Distribution



૮.૩ ઝડપ ઉદ્દીના કેસોનું ઝોન વાઈજ પત્રક

નં	ઝોનનું નામ	૨૦૧૦		૨૦૧૧	
		કુલ	%	કુલ	%
૧	મધ્ય ઝોન	૮૭૪	૧૧.૪	૩૬૧	૮.૧
૨	પર્ચ મ ઝોન	૧૫૩	૨.૫	૧૦૧	૨.૩
૩	નવા પર્ચ મ ઝોન	૨૪૬	૩.૨	૧૨૧	૨.૭
૪	ઉત્તર ઝોન	૧૪૮૮	૧૮.૪	૮૮૦	૧૮.૬
૫	પૂર્વ ઝોન	૨૬૭૩	૩૪.૮	૧૪૮૩	૩૪.૪
૬	દક્ષિણ ઝોન	૨૧૮૬	૨૮.૬	૧૪૧૬	૩૧.૭
	કુલ	૭૬૭૩	૧૦૦.૦	૪૪૭૨	૧૦૦.૦

AGE cases Zonewise Distribution



૮.૪ કોલેરાના કેસોનું ઝોન વાઈજ પત્રક

નં	ઝોનનું નામ	૨૦૧૦		૨૦૧૧	
		કુલ	%	કુલ	%
૧	મધ્ય ઝોન	૪૧	૨૪.૮	૪	૭.૦
૨	પર્ચ મ ઝોન	૨૩	૧૩.૬	૬	૧૦.૫
૩	નવા પર્ચ મ ઝોન	૮	૪.૮	૪	૭.૦
૪	ઉત્તર ઝોન	૨૮	૧૭.૬	૧૧	૧૮.૩
૫	પૂર્વ ઝોન	૧૮	૧૧.૪	૧૦	૧૭.૪
૬	દક્ષિણ ઝોન	૪૫	૨૭.૩	૨૨	૩૮.૬
	કુલ	૧૬૫	૧૦૦.૦	૫૭	૧૦૦.૦

Cholera cases Zonewise Distribution



દિન:

૬.૧.૧ વર્ષ-૨૦૧૦ના કુમળાના કેસોની વોર્ડવાઈઝ માહીતી

AHMEDABAD MUNICIPAL CORPORATION (HEALTH EPIDEMIC)				
Jaundice Cases - 2010				
Sr.	Ward	2010		
	Central Zone	Cases	Per.(%)	
1	KHADIA	14	0.5	
2	KALUPUR	142	4.6	
3	DARIAPUR	142	4.6	
4	SHAHPUR	167	5.4	
5	RAIKHAD	177	5.7	
6	JAMALPUR	459	14.8	
7	DUDHESHWAR	34	1.1	
8	MADHUPURA	5	0.2	
9	GIRDHARNAGAR	19	0.6	
	West zone	0	0.0	
10	PALDI	12	0.4	
11	VASNA	27	0.9	
12	GHANDHIGRAM	6	0.2	
13	NAVRANGPURA	2	0.1	
14	S.P.STEDIAM	1	0.0	
15	NARANPURA	2	0.1	
16	NAVA VADAJ	13	0.4	
17	JUNA VADAJ	9	0.3	
18	SABARMATI	4	0.1	
19	MOTERA	0	0.0	
20	CHANDKHEDA	7	0.2	
	New West Zone	0	0.0	
21	KALI (Tragad,Jagatpur Ognaj,Gota.Chharodi ,Chenpur)	1 0 0	0.0 0.0 0.0	
22	RANIP	15	0.5	
23	CHANDLODIYA (Chandlodiy,Nirnaynager)	11 0	0.4 0.0	
24	GHATLODIYA	2	0.1	

25	THALTEJ (Sola,Bhadaj,Shilaj, Hebatpur).	0	0.0
26	BODAKDEV (Memnager,Aambali).	5	0.2
27	JODHPUR (Jodhpur,Vstrapur).	5	0.2
28	VEJALPUR	152	4.9
29	SARKHEJ	52	1.7
North Zone		0	0.0
30	ASARVA	47	1.5
31	NARODA-ROAD	39	1.3
32	SARASPUR	44	1.4
33	POTALIA	8	0.3
34	KUBERNAGAR	23	0.7
35	SARDARNAGAR	8	0.3
36	SAJPUR-BOGHA	13	0.4
37	THAKKAR NAGAR	18	0.6
38	NARODA MUTHIA	6	0.2
39	NEW NARODA(Nikol, Hanspura,..)	9	0.3
	New Asarva)	0	0.0
East Zone		0	0.0
40	BAPUNAGAR	65	2.1
41	RAKHIAL	33	1.1
42	GOMTIPUR	78	2.5
43	RAJPUR	12	0.4
44	AMRAIWADI	43	1.4
45	BHAIPURA HAT.	17	0.5
46	NIKOL ROAD	9	0.3
47	ODHAV	54	1.7
48	KHOKHRA- MAHEMD.	20	0.6
49	VASTRAL (Ramol,New Odhav	22	0.7
		0	0.0
South Zone		0	0.0
50	MANINAGAR	32	1.0
51	KANKARIA	52	1.7
52	BAHERAMPURA	286	9.3
53	DANILIMDA	364	11.8
54	BAGE-FIRDOSH	11	0.4
55	VATVA	175	5.7
56	ISANPUR	77	2.5

અ. ૧. ૨ વર્ષ-૨૦૧૧ના કમળાના કેસોની વોર્ડવાઈઝ માહીતી

AHMEDABAD MUNICIPAL CORPORATION (HEALTH EPIDEMIC)					
JAUNDICE CASES Up to 21/12/2011					
Sr.		Ward	2011		
Central Zone			Cases	Per. (%)	
1	KHADIA		68	1.0	
2	KALUPUR		267	4.0	
3	DARIAPUR		229	3.4	
4	SHAHPUR		261	3.9	
5	RAIKHAD		148	2.2	
6	JAMALPUR		826	12.3	
7	DUDHESHWAR		19	0.3	
8	MADHUPURA		16	0.2	
9	GIRDHARNAGAR		47	0.7	
West zone			0	0.0	
10	PALDI		18	0.3	
11	VASNA		82	1.2	
12	AMBAVADI		23	0.3	
13	NAVRANGPURA		8	0.1	
14	S.P.STEDIAM		3	0.0	
15	NARANPURA		4	0.1	
16	NAVAVADAJ		7	0.1	
17	JUNA VADAJ		25	0.4	
18	SABARMATI		9	0.1	
19	CHANDKHEDA-MOTERA		8	0.1	
New West Zone			0	0.0	
20	KALI		1	0.0	
21	GOTA		3	0.0	
22	RANIP		13	0.2	
23	CHANDLODIYA		12	0.2	
24	GHATLODIYA		8	0.1	
25	THALTEJ		2	0.0	
26	BODAKDEV		3	0.0	
27	JODHPUR		6	0.1	

28	VEJALPUR	317	4.7	
29	SARKHEJ	96	1.4	
North Zone		0	0.0	
30	ASARVA	87	1.3	
31	NARODA-ROAD	37	0.6	
32	SARASPUR	111	1.7	
33	INDIA COLONY	21	0.3	
34	KUBERNAGAR	45	0.7	
35	SARDARNAGAR	14	0.2	
36	SAJPUR-BOGHA	49	0.7	
37	THAKKAR NAGAR	27	0.4	
38	NARODA	55	0.8	
39	NOBLENAGAR	7	0.1	
40	KRUSHNANAGAR MEGHANINAGAR	20	0.3	
41		56	0.8	
East Zone		0	0.0	
42	BAPUNAGAR	261	3.9	
43	RAKHIAL	145	2.2	
44	GOMTIPUR	133	2.0	
45	RAJPUR	9	0.1	
46	AMRAIWADI	114	1.7	
47	BHAIPURA HAT.	34	0.5	
48	NIKOL	38	0.6	
49	ODHAV	104	1.6	
50	VIRATNAGAR	23	0.3	
51	VASTRAL	18	0.3	
52	MAHAVIRNAGAR	0	0.0	
53	ARBUDANAGAR	0	0.0	
54	RAMOL-HATHIJAN	57	0.9	
South Zone		0	0.0	
55	MANINAGAR	61	0.9	
56	KANKARIA	202	3.0	
57	BAHERAMPURA	920	13.7	
58	DANILIMDA	753	11.2	
59	GHODASAR	22	0.3	
60	VATVA	377	5.6	
61	ISANPUR	219	3.3	
62	LAMBHA	102	1.5	
63	INDRAPURI	26	0.4	
64	KHOKHRA	29	0.4	
		0	0.0	
		0	0.0	

		0	0.0	
		0	0.0	
	TOTAL	6705	100.0	
		0	0.0	
		0	0.0	
No.	Zone	Cases	Per.(%)	
1	Central Zone	1881	28.1	
2	West Zone	187	2.8	
3	N.West Zone	461	6.9	
4	North Zone	529	7.9	
5	East Zone	936	14.0	
6	South Zone	2711	40.4	
		6705	100.0	

૮.૧.૩ - કુમળાના કેસો માટે હાઈરીઝ વિસ્તારોનું આઈડેન્ટીફીક્શન : જોન વાઈજ

અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલ કુમળાના કુલ કેસોમાંથી જેમા વર્ષ- ૨૦૧૦માં મધ્ય જોનમાંથી ૩૭.૫% કેસો અને દક્ષિણ જોનમાં ૩૮.૬% કેસો નોંધાયેલ છે. વર્ષ- ૨૦૧૦ના કુલ કેસોમાંથી ૭૦% કેસો આ બન્ને જોનનાં થાય છે. જ્યારે વર્ષ- ૨૦૧૧માં મધ્ય જોનમાંથી ૨૮% કેસો અને દક્ષિણ જોનમાં ૪૦% કેસો નોંધાયેલ છે. જેથી વર્ષ- ૨૦૧૧ના કુલ કેસોમાંથી ૬૮% કેસો આ બન્ને જોનનાં થાય છે. તો આ બન્ને જોન પર વધારે ધ્યાન રાખવામાં આવે તો આવતા સમયમાં કમળા કેસો માં ધટાડો કરી શકાય. વધારામાં મધ્ય જોનમાં ૪૪% કેસો જમાલપુર વોર્ડમાં અને બીજા ૪૦% કેસો કાલુપુર, દરિયાપુર અને શાહપુર વોર્ડમાં નોંધાયેલ છે. અને ૧૪% કેસો બહેરામપુરા વોર્ડમાં, ૨૮% કેસો દાણીલીમડા વોર્ડમાં અને ૧૪% કેસો વટવા વોર્ડમાં નોંધાયેલ છે. આમ મધ્યજોનના ૮૦% કેસો જમાલપુર, કાલુપુર, શાહપુર અને દરિયાપુરમાં નોંધાયેલ. જ્યારે દક્ષિણ જોનમાં ૭૬% કેસો બહેરામપુરા, વટવા, દાણીલીમડા વોર્ડમાં નોંધાયેલ છે. તેથી ઉપરોક્ત અસરગ્રસ્લ વિસ્તારોમાં પુરતા રોગ અટકાયતી પગલાં હેલ્થ વિભાગ અને ઈજનેર વિભાગ દ્વારા લેવામાં આવે તો અસરકારક પરિણામ મેળવી શકાય તેમ છે. આ સાથે જોન દ્વારા ઓળખી બતાવેલ હાઈરીઝ વિસ્તારોનું લીસ્ટ સામેલ છે.

૬.૨.૧ વર્ષ-૨૦૧૦ના ટાઈફોઇડના કેસોની વોર્ડવાઇડ માહીતી

AHMEDABAD MUNICIPAL CORPORATION (HEALTH EPIDEMIC)				
Typhoid-CASES-2010				
S.no.	Ward	2010		
Central Zone		Cases	Per(%)	
1	KHADIA	6	0.8	
2	KALUPUR	3	0.4	
3	DARIAPUR	7	0.9	
4	SHAHPUR	11	1.4	
5	RAIKHAD	11	1.4	
6	JAMALPUR	26	3.3	
7	DUDHESHWAR	6	0.8	
8	MADHUPURA	2	0.3	
9	GIRDHARNAGAR	7	0.9	
West zone			0.0	
10	PALDI	8	1.0	
11	VASNA	9	1.2	
12	GHANDHIGRAM	6	0.8	
13	NAVRANGPURA	2	0.3	
14	S.P.STEDIAM	2	0.3	
15	NARANPURA	0	0.0	
16	NAVA VADAJ	1	0.1	
17	JUNA VADAJ	5	0.6	
18	SABARMATI	2	0.3	
19	MOTERA	0	0.0	
20	CHANDKHEDA	2	0.3	
New West Zone			0.0	
21	KALI (Tragad,Jagatpur	1	0.1	
	Ognaj,Gota.Ccharodi	0	0.0	
	,Chenpur)	0	0.0	
22	RANIP	0	0.0	
23	CHANDLODIYA	0	0.0	
	(Chadlodiya,Nirnaynager)	0	0.0	
24	GHATLODIYA	2	0.3	
25	THALTEJ	1	0.1	
	(Sola,Bhadaj,Shilaj,	0	0.0	
	Hebatpur).	0	0.0	
26	BODAKDEV	1	0.1	
	(Memnager,Aambali).	0	0.0	
27	JODHPUR	1	0.1	

	(Jodhpur,Vstrapur).		0	0.0
28	VEJALPUR		20	2.6
29	SARKHEJ		6	0.8
	North Zone			0.0
30	ASARVA		31	4.0
31	NARODA-ROAD		26	3.3
32	SARASPUR		47	6.0
33	POTALIA		10	1.3
34	KUBERNAGAR		9	1.2
35	SARDARNAGAR		2	0.3
36	SAJPUR-BOGHA		10	1.3
37	THAKKAR NAGAR		21	2.7
38	NARODA MUTHIA		1	0.1
39	NEW NARODA(Nikol, Hanspura,..		10	1.3
	New Asarva)			0.0
	East Zone			0.0
40	BAPUNAGAR		86	11.1
41	RAKHIAL		42	5.4
42	GOMTIPUR		23	3.0
43	RAJPUR		5	0.6
44	AMRAIWADI		55	7.1
45	BHAIPURA HAT.		5	0.6
46	NIKOL ROAD		12	1.5
47	ODHAV		61	7.8
48	KHOKHRA-MAHEMD.		11	1.4
49	VASTRAL		18	2.3
	(Ramol,New Odhav		0	0.0
	South Zone		0	0.0
50	MANINAGAR		11	1.4
51	KANKARIA		12	1.5
52	BAHERAMPURA		22	2.8
53	DANILIMDA		19	2.4
54	BAGE-FIRDOSH		10	1.3
55	VATVA		47	6.0
56	ISANPUR		16	2.1
57	LAMBHA		8	1.0
	(Gyaspur,Pipalaj,,		0	0.0
	Shahvadi,Kamod,,		0	0.0
	Indiranager,Laxmipura,		0	0.0
	New Vatva.Sajipur		0	0.0
	Vinzol		0	0.0
			0	0.0

		0	0.0
	TOTAL	778	100.0
	ZONEWISE CASES		
No.	Zone	Cases	Per(%)
1	Central Zone	79	10.2
2	West Zone	37	4.8
3	N.West Zone	32	4.1
4	North Zone	167	21.5
5	East Zone	318	40.9
6	South Zone	145	18.6
		778	100.0

૬.૨.૨ વર્ષ-૨૦૧૧ના ટાઇફોઇડના કેસોની વોર્ડવાઈજ માહીતી

AHMEDABAD MUNICIPAL CORPORATION (HEALTH EPIDEMIC)				
TYPHOID CASES-2011				
Sr.	Ward	2011	Cases	Per(%)
	Central Zone			
1	KHADIA		7	0.5
2	KALUPUR		24	1.8
3	DARIAPUR		9	0.7
4	SHAHPUR		49	3.6
5	RAIKHAD		15	1.1
6	JAMALPUR		48	3.5
7	DUDHESHWAR		15	1.1
8	MADHUPURA		3	0.2
9	GIRDHARNAGAR		15	1.1
	West zone		0	0.0
10	PALDI		23	1.7
11	VASNA		26	1.9
12	AMBAVADI		35	2.6
13	NAVRANGPURA		9	0.7
14	S.P.STEDIAM		0	0.0
15	NARANPURA		2	0.1
16	NAVA VADAJ		6	0.4
17	JUNA VADAJ		12	0.9
18	SABARMATI		1	0.1
19	CHANDKHEDA-MOTERA		4	0.3
	New West Zone		0	0.0
20	KALI		2	0.1
21	GOTA		1	0.1
22	RANIP		5	0.4
23	CHANDLODIYA		3	0.2
24	GHATLODIYA		2	0.1
25	THALTEJ		2	0.1
26	BODAKDEV		10	0.7
27	JODHPUR		8	0.6
28	VEJALPUR		76	5.6
29	SARKHEJ		27	2.0
	North Zone		0	0.0
30	ASARVA		28	2.1
31	NARODA-ROAD		19	1.4

32	SARASPUR	79	5.8
33	INDIA COLONY	11	0.8
34	KUBERNAGAR	16	1.2
35	SARDARNAGAR	8	0.6
36	SAJPUR-BOGHA	23	1.7
37	THAKKAR NAGAR	15	1.1
38	NARODA	20	1.5
39	NOBLENAGAR	4	0.3
40	KRUSHNANAGAR	9	0.7
41	MEGHANINAGAR	14	1.0
East Zone		0	0.0
42	BAPUNAGAR	112	8.3
43	RAKHIAL	60	4.4
44	GOMTIPUR	57	4.2
45	RAJPUR	7	0.5
46	AMRAIWADI	48	3.5
47	BHAIPURA HAT.	17	1.3
48	NIKOL	13	1.0
49	ODHAV	65	4.8
50	VIRATNAGAR	6	0.4
51	VASTRAL	15	1.1
52	MAHAVIRNAGAR	0	0.0
53	ARBUDANAGAR	1	0.1
54	RAMOL-HATHIJAN	14	1.0
South Zone		0	0.0
55	MANINAGAR	13	1.0
56	KANKARIA	16	1.2
57	BAHERAMPURA	50	3.7
58	DANILIMDA	59	4.4
59	GHODASAR	9	0.7
60	VATVA	54	4.0
61	ISANPUR	22	1.6
62	LAMBHA	11	0.8
63	INDRAPURI	9	0.7
64	KHOKHRA	12	0.9
		0	0.0
		0	0.0
		0	0.0
	TOTAL	1355	100.0

No.	Zone	Cases	Per(%)
1	Central Zone	185	13.7
2	West Zone	118	8.7
3	N.West Zone	136	10.0
4	North Zone	246	18.2
5	East Zone	415	30.6
6	South Zone	255	18.8
		1355	100.0

૮.૨.૩ - ટાઈફોઇડના કેસો માટે હાઈરીઝ વિસ્તારોનું આઈડેન્ટીફીકેશન : જોન વાઈડ

અમદાવાદ ખુનિસિપલ કોર્પોરશનમાં નોંધાયેલ ટાઈફોઇડના કુલ કેસોમાંથી જેમા વર્ષ-૨૦૧૦માં પૂર્વ જોનમાંથી ૪૦.૮% કેસો અને દક્ષિણ જોનમાં ૧૮.૬% કેસો તેમજ ઉત્તર જોનમાં ૨૧.૬% કેસો નોંધાયેલ છે. વર્ષ-૨૦૧૦ના કુલ કેસોમાંથી ૮૧.૧% કેસો આ ત્રણ જોનનાં થાય છે. જ્યારે વર્ષ-૨૦૧૧માં પૂર્વ જોનમાંથી ૩૦.૬% કેસો અને દક્ષિણ જોનમાં ૧૮.૮% કેસો તેમજ ઉત્તર જોનમાં ૧૮.૨% કેસો નોંધાયેલ છે. જેથી વર્ષ-૨૦૧૧ના કુલ કેસોમાંથી ૬૭.૬% કેસો આ ત્રણ જોનનાં થાય છે. તો આ ત્રણ જોન પર વધારે ધ્યાન રાખવામાં આવે તો આવતા સમયમાં ડાઈફોઇડ કેસો માં ધટાડો કરી શકાય. વધારામાં પૂર્વ જોનમાં ૨૭% કેસો બાપુનગર વોર્ડમાં અને બીજા ૫૫.૫% કેસો ઓઠવ, રખિયાલ, ગોમતીપુર અને અમરાઈવાડી વોર્ડમાં નોંધાયેલ છે. અને ૨૩.૧% કેસો દાણીલીમડા વોર્ડમાં, ૧૮.૬% બહેરામપુરા કેસો વોર્ડમાં અને ૨૧.૨% કેસો વટવા વોર્ડમાં નોંધાયેલ છે. અને ૩૨.૧% કેસો સરસપુર વોર્ડમાં, ૨૦.૭% અસારવા, સૈજપુર કેસો વોર્ડમાં નોંધાયેલ છે. આમ પૂર્વજોનના ૮૨.૫% કેસો બાપુનગર, ઓઠવ, રખિયાલ, ગોમતીપુર અને અમરાઈવાડી વોર્ડમાં નોંધાયેલ. જ્યારે દક્ષિણ જોનમાં ૬૩.૮% કેસો બહેરામપુરા, વટવા, દાણીલીમડા વોર્ડમાં નોંધાયેલ છે. અને ઉત્તર જોનમાં ૫૨.૮% સરસપુર, અસારવા, સૈજપુર વોર્ડમાં નોંધાયેલ છે. તેથી ઉપરોક્ત અસરગ્રસ્ત વિસ્તારોમાં પુરતા રોગ અટકાયતી પગલાં હેલ્થ વિભાગ અને ઈજનેર વિભાગ દ્વારા લેવામાં આવે તો અસરકારક પરિણામ મેળવી શકાય તેમ છે. આ સાથે જોન દ્વારા ઓળખી બતાવેલ હાઈરીઝ વિસ્તારોનું લીસ્ટ સામેલ છે.

૬.૩.૧ વર્ષ-૨૦૧૦ના ઝડપ ઉદ્દીના કેસોની વોર્ડવાઈજ માહીતી

AHMEDABAD MUNICIPAL CORPORATION (HEALTH EPIDEMIC)				
G.E.CASES-2010				
Sr.	Ward	2010		
Central Zone		Cases	Per(%)	
1	KHADIA	58	0.8	
2	KALUPUR	137	1.8	
3	DARIAPUR	93	1.2	
4	SHAHPUR	92	1.2	
5	RAIKHAD	126	1.6	
6	JAMALPUR	235	3.1	
7	DUDHESHWAR	54	0.7	
8	MADHUPURA	28	0.4	
9	GIRDHARNAGAR	51	0.7	
West zone			0.0	
10	PALDI	26	0.3	
11	VASNA	41	0.5	
12	GHANDHIGRAM	11	0.1	
13	NAVRANGPURA	26	0.3	
14	S.P.STEDIAM	11	0.1	
15	NARANPURA	4	0.1	
16	NAVA VADAJ	18	0.2	
17	JUNA VADAJ	38	0.5	
18	SABARMATI	10	0.1	
19	MOTERA	1	0.0	
20	CHANDKHEDA	7	0.1	
New West Zone			0.0	
21	KALI (Tragad,Jagatpur	4	0.1	
	Ognaj,Gota.Chharodi		0.0	
	,Chenpur)		0.0	
22	RANIP	23	0.3	
23	CHANDLODIYA	11	0.1	
	(Chadlodiya,Nirnaynager)		0.0	
24	GHATLODIYA	5	0.1	
25	THALTEJ	2	0.0	
	(Sola,Bhadaj,Shilaj,		0.0	
	Hebatpur).		0.0	
26	BODAKDEV	5	0.1	
	(Memnager,Aambali).		0.0	
27	JODHPUR	8	0.1	
	(Jodhpur,Vstrapur).		0.0	

28	VEJALPUR	129	1.7
29	SARKHEJ	62	0.8
	North Zone		0.0
30	ASARVA	239	3.1
31	NARODA-ROAD	246	3.2
32	SARASPUR	445	5.8
33	POTALIA	105	1.4
34	KUBERNAGAR	94	1.2
35	SARDARNAGAR	33	0.4
36	SAIJPUR-BOGHA	105	1.4
37	THAKKAR NAGAR	138	1.8
38	NARODA MUTHIA	13	0.2
39	NEW NARODA(Nikol,	70	0.9
	Hanspura.,.		0.0
	New Asarva)		0.0
	East Zone		0.0
40	BAPUNAGAR	542	7.1
41	RAKHIAL	384	5.0
42	GOMTIPUR	400	5.2
43	RAJPUR	55	0.7
44	AMRAIWADI	390	5.1
45	BHAIPURA HAT.	123	1.6
46	NIKOL ROAD	96	1.3
47	ODHAV	416	5.4
48	KHOKHRA-MAHEMD.	111	1.4
49	VASTRAL	156	2.0
	(Ramol,New Odhav		0.0
	South Zone		0.0
50	MANINAGAR	136	1.8
51	KANKARIA	124	1.6
52	BAHERAMPURA	328	4.3
53	DANILIMDA	583	7.6
54	BAGE-FIRDOSH	102	1.3
55	VATVA	494	6.4
56	ISANPUR	269	3.5
57	LAMBHA	160	2.1
	(Gyaspur,Pipalaj,,		0.0
	Shahvadi,Kamod,,		0.0
	Indiranager,Laxmipura,		0.0
	New Vatva.Saijpur		0.0
	Vinzol		0.0
			0.0

	TOTAL	7673	100.0
No.	Zone	Cases	Per(%)
1	Central Zone	874	11.4
2	West Zone	193	2.5
3	N.West Zone	249	3.2
4	North Zone	1488	19.4
5	East Zone	2673	34.8
6	South Zone	2196	28.6
		7673	100.0

૬.૩.૨ વર્ષ-૨૦૧૧ના ઝડપ ઉલ્ટીના કેસોની વોર્ડવાઈજ માહીતી

AHMEDABAD MUNICIPAL CORPORATION (HEALTH EPIDEMIC)			
G.E.CASES-2011			
	Ward	2011	
	Central Zone	Cases	Per(%)
1	KHADIA	18	0.4
2	KALUPUR	40	0.9
3	DARIAPUR	36	0.8
4	SHAHPUR	44	1.0
5	RAIKHAD	37	0.8
6	JAMALPUR	106	2.4
7	DUDHESHWAR	8	0.2
8	MADHUPURA	18	0.4
9	GIRDHARNAGAR	54	1.2
	West zone	0	0.0
10	PALDI	13	0.3
11	VASNA	21	0.5
12	AMBAVADI	2	0.0
13	NAV RANGPURA	3	0.1
14	S.P.STEDIAM	3	0.1
15	NARANPURA	4	0.1
16	NAVAVADAJ	7	0.2
17	JUNA VADAJ	25	0.6
18	SABARMATI	12	0.3
19	CHANDKHEDA-MOTERA	11	0.2
	New West Zone	0	0.0
20	KALI	0	0.0
21	GOTA	2	0.0
22	RANIP	9	0.2
23	CHANDLODIYA	10	0.2
24	GHATLODIYA	4	0.1
25	THALTEJ	1	0.0
26	BODAKDEV	2	0.0
27	JODHPUR	4	0.1
28	VEJALPUR	62	1.4
29	SARKHEJ	27	0.6
	North Zone	0	0.0
30	ASARVA	92	2.1
31	NARODA-ROAD	81	1.8
32	SARASPUR	296	6.6

No.	Zone	Cases	Per(%)
33	INDIA COLONY	38	0.8
34	KUBERNAGAR	67	1.5
35	SARDARNAGAR	16	0.4
36	SAIJPUR-BOGHA	78	1.7
37	THAKKAR NAGAR	45	1.0
38	NARODA	77	1.7
39	NOBLENAGAR	6	0.1
40	KRUSHNANAGAR	23	0.5
	MEGHANINAGAR		
41		71	1.6
East Zone		0	0.0
42	BAPUNAGAR	345	7.7
43	RAKHIAL	213	4.8
44	GOMTIPUR	227	5.1
45	RAJPUR	10	0.2
46	AMRAIWADI	263	5.9
47	BHAIPURA HAT.	78	1.7
48	NIKOL	45	1.0
49	ODHAV	217	4.9
50	VIRATNAGAR	45	1.0
51	VASTRAL	40	0.9
52	MAHAVIRNAGAR	0	0.0
53	ARBUDANAGAR	0	0.0
54	RAMOL-HATHIJAN	100	2.2
South Zone		0	0.0
55	MANINAGAR	101	2.3
56	KANKARIA	87	1.9
57	BAHERAMPURA	181	4.0
58	DANILIMDA	258	5.8
59	GHODASAR	42	0.9
60	VATVA	259	5.8
61	ISANPUR	230	5.1
62	LAMBHA	137	3.1
63	INDRAPURI	51	1.1
64	KHOKHRA	70	1.6
		0	0.0
		0	0.0
		0	0.0
		0	0.0
	TOTAL	4472	100.0

1	Central Zone	361	8.1
2	West Zone	101	2.3
3	N.West Zone	121	2.7
4	North Zone	890	19.9
5	East Zone	1583	35.4
6	South Zone	1416	31.7
		4472	100.0

ઝડા ઉલ્ટીના કેસો માટે હાઈરીઝ વિસ્તારોનું આઇન્ટીઝીકેશન : જોન વાઈજ

અમદાવાદ ભૂનિક્ષિપલ કોર્પોરશનમાં નોંધાયેલ ઝડા ઉલ્ટીના કુલ કેસોમાંથી જેમા વર્ષ-૨૦૧૦માં પૂર્વ જોનમાંથી ૩૪.૮% કેસો અને દક્ષિણ જોનમાં ૨૮.૬% કેસો તેમજ ઉત્તર જોનમાં ૧૮.૪% કેસો નોંધાયેલ છે. વર્ષ-૨૦૧૦ના કુલ કેસોમાંથી ૮૨.૮% કેસો આ ત્રણ જોનનાં થાય છે. જ્યારે વર્ષ-૨૦૧૧માં પૂર્વ જોનમાંથી ૩૫.૪% કેસો અને દક્ષિણ જોનમાં ૩૧.૭% કેસો તેમજ ઉત્તર જોનમાં ૧૮.૮% કેસો નોંધાયેલ છે. જેથી વર્ષ-૨૦૧૧ના કુલ કેસોમાંથી ૮૭% કેસો આ ત્રણ જોનનાં થાય છે. તો આ ત્રણ જોન પર વધારે ધ્યાન રાખવામાં આવે તો આવતા સમયમાં ઝડા ઉલ્ટીના કેસો માં ધટાડો કરી શકાય. વધારામાં પૂર્વ જોનમાં ૨૧.૮% કેસો બાપુનગર વોર્ડમાં અને બીજા ૫૮.૧% કેસો ઓઠવ, રખિયાલ, ગોમતીપુર અને અમરાઈવાડી વોર્ડમાં નોંધાયેલ છે. અને ૧૮.૨% કેસો દાણીલીમડા વોર્ડમાં, ૧૬.૨% ઈસનપુર કેસો વોર્ડમાં અને ૧૮.૩% કેસો વટવા વોર્ડમાં નોંધાયેલ છે. અને ૩૩.૩% કેસો સરસપુર વોર્ડમાં, ૨૮.૨% અસારવા, નરોડા રોડ, સૈજપુર કેસો વોર્ડમાં નોંધાયેલ છે. આમ પૂર્વઝોનના ૭૮.૮% કેસો બાપુનગર, ઓઠવ, રખિયાલ, ગોમતીપુર અને અમરાઈવાડી વોર્ડમાં નોંધાયેલ. જ્યારે દક્ષિણ જોનમાં ૫૨.૭% કેસો ઈસનપુર, વટવા, દાણીલીમડા વોર્ડમાં નોંધાયેલ છે. અને ઉત્તર જોનમાં ૬૧.૫% સરસપુર, અસારવા, સૈજપુર, નરોડા રોડ વોર્ડમાં નોંધાયેલ છે. તેથી ઉપરોક્ત અસરગ્રસ્ત વિસ્તારોમાં પુરતા રોગ અટકાયતી પગલાં હેલ્થ વિભાગ અને ઈજનેર વિભાગ દ્વારા લેવામાં આવે તો અસરકારક પરિણામ મેળવી શકાય તેમ છે. આ સાથે જોન દ્વારા ઓળખી બતાવેલ હાઈરીઝ વિસ્તારોનું લીસ્ટ સામેલ છે.

૬.૪.૧ વર્ષ-૨૦૧૦ના કોલેરાના કેસોની વોર્ડવાઈઝ માહીતી

AHMEDABAD MUNICIPAL CORPORATION (HEALTH EPIDEMIC)				
Cholera-CASES-2010				
S.no.	Ward	2010		
Central Zone		Cases	Per(%)	
1	KHADIA	1	0.6	
2	KALUPUR	7	4.2	
3	DARIAPUR	8	4.8	
4	SHAHPUR	4	2.4	
5	RAIKHAD	1	0.6	
6	JAMALPUR	6	3.6	
7	DUDHESHWAR	6	3.6	
8	MADHUPURA	5	3.0	
9	GIRDHARNAGAR	3	1.8	
West zone		0	0.0	
10	PALDI	2	1.2	
11	VASNA	4	2.4	
12	GHANDHIGRAM	2	1.2	
13	NAVRANGPURA	8	4.8	
14	S.P.STEDIAM	0	0.0	
15	NARANPURA	1	0.6	
16	NAVAVADAJ	3	1.8	
17	JUNA VADAJ	3	1.8	
18	SABARMATI	0	0.0	
19	MOTERA	0	0.0	
20	CHANDKHEDA	0	0.0	
New West Zone		0	0.0	
21	KALI (Tragad,Jagatpur	0	0.0	
	Ognaj,Gota.Chharodi	0	0.0	
	,Chenpur)	0	0.0	
22	RANIP	2	1.2	
23	CHANDLODIYA	1	0.6	
	(Chadlodiy,Nirnaynager)	0	0.0	
24	GHATLODIYA	0	0.0	
25	THALTEJ	1	0.6	
	(Sola,Bhadaj,Shilaj,	0	0.0	
	Hebatpur).	0	0.0	
26	BODAKDEV	0	0.0	
	(Memnager,Aambali).	0	0.0	
27	JODHPUR	0	0.0	
	(Jodhpur,Vstrapur).	0	0.0	

28	VEJALPUR	1	0.6
29	SARKHEJ	3	1.8
	North Zone	0	0.0
30	ASARVA	1	0.6
31	NARODA-ROAD	5	3.0
32	SARASPUR	0	0.0
33	POTALIA	0	0.0
34	KUBERNAGAR	2	1.2
35	SARDARNAGAR	7	4.2
36	SAIJPUR-BOGHA	7	4.2
37	THAKKAR NAGAR	3	1.8
38	NARODA MUTHIA	1	0.6
39	NEW NARODA(Nikol, Hanspura.,	3	1.8
	New Asarva)	0	0.0
		0	0.0
	East Zone	0	0.0
40	BAPUNAGAR	2	1.2
41	RAKHIAL	2	1.2
42	GOMTIPUR	4	2.4
43	RAJPUR	1	0.6
44	AMRAIWADI	0	0.0
45	BHAIPURA HAT.	1	0.6
46	NIKOL ROAD	0	0.0
47	ODHAV	3	1.8
48	KHOKHRA-MAHEMD.	2	1.2
49	VASTRAL (Ramol,New Odhav	4	2.4
		0	0.0
	South Zone	0	0.0
50	MANINAGAR	0	0.0
51	KANKARIA	1	0.6
52	BAHERAMPURA	6	3.6
53	DANILIMDA	14	8.5
54	BAGE-FIRDOSH	1	0.6
55	VATVA	5	3.0
56	ISANPUR	8	4.8
57	LAMBHA (Gyaspur,Pipalaj,,	10	6.1
	Shahvadi,Kamod,,	0	0.0
	Indiranager,Laxmipura,	0	0.0
	New Vatva.Saijpur	0	0.0
	Vinzol	0	0.0
		0	0.0
			0.0

	TOTAL	165	100.0
No.	Zone	Cases	Per(%)
1	Central Zone	41	24.8
2	West Zone	23	13.9
3	N.West Zone	8	4.8
4	North Zone	29	17.6
5	East Zone	19	11.5
6	South Zone	45	27.3
		165	100.0

૬.૪.૨ વર્ષ-૨૦૧૧ના કોલેરાના કેસોની વોર્ડવાઈઝ માહીતી

AHMEDABAD MUNICIPAL CORPORATION (HEALTH EPIDEMIC)				
CHOLERA CASES-2011				
Sr.	Ward	2011		
Central Zone		Cases	Per(%)	
1	KHADIA	0	0	
2	KALUPUR	0	0	
3	DARIAPUR	0	0	
4	SHAHPUR	1	1.8	
5	RAIKHAD	1	1.8	
6	JAMALPUR	1	1.8	
7	DUDHESHWAR	0	0	
8	MADHUPURA	0	0	
9	GIRDHARNAGAR	1	1.8	
West zone		0	0	
10	PALDI	1	1.8	
11	VASNA	1	1.8	
12	AMBAVADI	1	1.8	
13	NAVRANGPURA	0	0	
14	S.P.STEDIAM	1	1.8	
15	NARANPURA	0	0	
16	NAVA VADAJ	0	0	
17	JUNA VADAJ	2	3.51	
18	SABARMATI	0	0	
19	CHANDKHEDA-MOTERA	0	0	
New West Zone		0	0	
20	KALI	1	1.8	
21	GOTA	0	0	
22	RANIP	0	0	
23	CHANDLODIYA	1	1.8	
24	GHATLODIYA	0	0	
25	THALTEJ	0	0	
26	BODAKDEV	0	0	
27	JODHPUR	0	0	
28	VEJALPUR	1	1.8	
29	SARKHEJ	1	1.8	
North Zone		0	0	
30	ASARVA	1	1.8	
31	NARODA-ROAD	0	0	

32	SARASPUR	1	1.8
33	INDIA COLONY	0	0
34	KUBERNAGAR	3	5.3
35	SARDARNAGAR	0	0
36	SAJPUR-BOGHA	2	3.5
37	THAKKAR NAGAR	0	0
38	NARODA	0	0
39	NOBLENAGAR	1	1.8
40	KRUSHNANAGAR	0	0
41	MEGHANINAGAR	3	5.3
East Zone		0	0
42	BAPUNAGAR	0	0
43	RAKHIAL	0	0
44	GOMTIPUR	2	3.5
45	RAJPUR	1	1.8
46	AMRAIWADI	0	0
47	BHAIPURA HAT.	0	0
48	NIKOL	1	1.8
49	ODHAV	0	0
50	VIRATNAGAR	0	0
51	VASTRAL	2	3.5
52	MAHAVIRNAGAR	2	3.5
53	ARBUDANAGAR	0	0
54	RAMOL-HATHIJAN	2	3.5
South Zone		0	0
55	MANINAGAR	0	0
56	KANKARIA	2	3.5
57	BAHERAMPURA	6	10.5
58	DANILIMDA	1	1.8
59	GHODASAR	0	0
60	VATVA	3	5.3
61	ISANPUR	0	0
62	LAMBHA	10	17.5
63	INDRAPURI	0	0
64	KHOKHRA	0	0
		0	0
		0	0
		0	0
		0	0
	TOTAL	57	100

No.	Zone	Cases	Per(%)
1	Central Zone	4	7.0
2	West Zone	6	10.5
3	N.West Zone	4	7.0
4	North Zone	11	19.3
5	East Zone	10	17.5
6	South Zone	22	38.6
		57	100.0

૮.૪.૩ - કોલેરા માટે હાઈરીસ્ક વિસ્તારોનું આઇડેન્ટીફીકેશન : ઝોન વાઈઝ

અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલ કોલેરાના કુલ કેસોમાંથી જેમા વર્ષ-૨૦૧૦માં મધ્ય ઝોનમાંથી ૨૪.૮% કેસો અને દક્ષિણ ઝોનમાં ૨૭.૩% કેસો તેમજ ઉત્તર ઝોનમાં ૧૭.૬% કેસો નોંધાયેલ છે. વર્ષ-૨૦૧૦ના કુલ કેસોમાંથી ૬૮.૭% કેસો આ ત્રણ ઝોનનાં થાય છે. જ્યારે વર્ષ-૨૦૧૧માં પૂર્વ ઝોનમાંથી ૧૭.૫% કેસો અને દક્ષિણ ઝોનમાં ૩૮.૬% કેસો તેમજ ઉત્તર ઝોનમાં ૧૮.૩% કેસો નોંધાયેલ છે. જેથી વર્ષ-૨૦૧૧ના કુલ કેસોમાંથી ૭૫.૪% કેસો આ ત્રણ ઝોનનાં થાય છે. તો આ ત્રણ ઝોન પર વધારે ધ્યાન રાખવામાં આવે તો આવતા સમયમાં કોલેરાના કેસો માં ધટાડો કરી શકાય. વધારામાં પૂર્વ ઝોનમાં ૨૦% કેસો વસ્ત્રાલ વોર્ડમાં, ૨૦% કેસો મહાવીરનગર વોર્ડમાં અને બીજા ૪૦% કેસો ગોમતીપુર અને રામોલ વોર્ડમાં નોંધાયેલ છે. અને ૪૫.૫% કેસો લાંબા વોર્ડમાં, ૨૭.૩% બહેરામપુરા કેસો વોર્ડમાં અને ૧૩.૬% કેસો વટવા વોર્ડમાં નોંધાયેલ છે. અને ૨૭.૩% કેસો કુબેરનગર વોર્ડમાં, ૪૫.૫% અસારવા, સરસપુર, નોબલનગર, સૈજપુર કેસો વોર્ડમાં નોંધાયેલ છે. આમ પૂર્વઝોનના ૮૦% કેસો વસ્ત્રાલ, મહાવીરનગર, રામોલ, ગોમતીપુર વોર્ડમાં નોંધાયેલ. જ્યારે દક્ષિણ ઝોનમાં ૮૪.૬% કેસો લાંબા, વટવા, બહેરામપુરા વોર્ડમાં નોંધાયેલ છે. અને ઉત્તર ઝોનમાં ૭૨.૮% કુબેરનગર, સરસપુર, અસારવા, સૈજપુર, વોર્ડમાં નોંધાયેલ છે. તેથી ઉપરોક્ત અસરગ્રસ્ત વિસ્તારોમાં પુરતા રોગ અટકાયતી પગલાં હેઠ્થ વિભાગ અને ઈજનેર વિભાગ દ્વારા લેવામાં આવે તો અસરકારક પરિણામ મેળવી શકાય તેમ છે. આ સાથે ઝોન દ્વારા ઓળખી બતાવેલ હાઈરીસ્ક વિસ્તારોનું લીસ્ટ સામેલ છે.

૧૦. હાઈરીસ્ક વિસ્તારોનું આઈડેન્ટીફીકેશન : ઝોન વાઈજ

ક્રમ	ઝોનનું નામ	વોડનું નામ	વિસ્તારનું નામ
૧	પશ્ચિમ ઝોન	પાલડી	સુખીપુરા, હીરાબાગ રેલ્વે કોસીગા
		વાસણા	શુપાનગર, પ્રવિષ્ણનગર, સોરાઈનગર, મંગળતળાવ, સોમે રનગર
		આબાંવાડી	આંબેડકર કોલોની રાજીવનગર ભીખાજ ની ચાલી
		નવરંગપુરા	ગુલબાઈ ટેકરા
		સ્ટેડીયમ	ઓડ નો ટેકરો, નટના ધાપરા
		નારણપુરા	સંજયનગર, ચામુંડાનગર
		નવા વાડજ	ચંદ્રભાગા હાઉસીગા
		જુના વાડજ	રામાપીર નો ટેકરો
		સાબરમતી	વેલજીમાઈ નો કુવો, કેલાશનગર, જે. પી. ની ચાલી
		ચાંદખેડા-મોટેરા	શુ. હા. બોર્ડ નસરીવિસ્તાર-વિસ્તત પેટ્રોલ પંપ ની પાછળ
૨	દક્ષિણ ઝોન	બહેરામપુરા અને લાંભા	બેરલ માર્કેટની પાછળના વિસ્તારથી સીટીજનનગર થી ઈલાબેનના ઘાટ થી નારોલ સર્કલથી બોંઘે હોટલથી બેરલ માર્કેટ , સાઈટ એન્ડ સર્વીસ બાબુનગર, હમીદવાડી, રામરહીમનો ટેકરો, સંતોષનગર, ખોરીયારનગર અને અલ્લાહનગરનો વિસ્તાર , ધીપા સોસાયટી, નગ્માનગર, શાહેઆલમ નગર, પટેલનું મેદાન, મુસ્લીમ સોસાયટી અને શક્તિન સોસાયટી
		લાંભા	નારોલ કોર્ટની પાછળનો વિસ્તાર રંગોલીનગર, જ્યોતીનગર , વિગેરે અને અલીફનગર એકતાનગર, હીના પાર્ક, બાગેકૌશર, બાગેહસન, તેમજ આજુબાજુનો વિસ્તાર , બચુભાઈનો કુવો નવા વિજોલનો આજુબાજુનો વિસ્તાર મદાસીનીચાલી, જાનીયા પીરનો ટેકરો, ગોકુલધામ, બચુનગર, વિગેરે તથા કુતુબનગર ગલીન. ૧થી ૧૩
		દાણીલીમડા	જતુભગત કંમ્પાઉન્ડ અને ઉર નં. પ્લોટનો વિસ્તાર

३	नवा पश्चिमज़ोन	काणी	ખોડીયારનગર, ઠાકોરવાસ, ગણેશનગર, ગાયત્રીજનરલ	રણધોડનગર,
		ચાંદલોડિયા	શિવશક્તિનગર, સંતરોહિદાસનગર, રૂખીબાનગર, નહરીપાર્ક, ગણેશનગર	
		વેજલપુર	અંજુમપાર્ક, બાવાપાર્ક., યાસ્મીનસોસા. તથા વિસ્તાર, સંકલીતનગર, જલક રોડ, સમાસોસા. વૈભવીસોસા.	
		સરખેજ	સંકલીતનગર, બરફની ફેક્ટરી રોડ, ફિલેવાડી(ભાઈ), શક્તિનગર, ફિલેવાડી, નહેરનગર, રાજ્યનગર	
४	મધ્ય ઝોન	જમાલપુર	મોટા બંબા, મહાજનનો વંડો, કાચની મસજિદ, સોમનાથ ભુદરનો આરો	
५	ઉત્તરજોન	કૃષ્ણનગર	અવધ ફ્લેટ, નિલકંઠ સોસાયટી, અંજના પાર્ક, શિવશક્તિ ફ્લેટ, ઉમંગ સોસાયટી અને ટેનામેન્ટ, વંદના પાર્ક સોસાયટી, વિરમનગર, વિ એસ ફ્લેટ	
		ઈન્ડિયાકોલોની	ઘનશ્યામ પાર્ક સોસાયટી અને ઘનશ્યામ ફ્લેટ, ડેલાશ પાર્ક, કમલે ૨ પાર્ક, કશ્યાવટી ફ્લેટ, કી ૧ એપાર્ટ, લક્ષ્મીનારાયણ સોસાયટી, માધવ ફ્લેટ અને ટેનામેન્ટ, મનમોહન ફ્લેટ, મધુર પાર્ક સોસા, સંસ્કાર ફ્લેટ, સોનલ પાર્ક, વિરલ એપાર્ટમેન્ટ	
		ઠંકુરનગર	નંદલવન, અશરવિલા ફ્લેટ, સરદારપાર્ક, વૃન્દાવન પાર્ક, બદ્ધીનારાયણ સોસાયટી, ઉમાપાર્ક સોસાયટી, રાષ્ટ્ર એપાર્ટમેન્ટ, નિધી પાર્ક	
૬	પૂર્વજોન	બાપુનગર	ગુ. હા. બોર્ડ ગાયત્રી મંદિરની પાછળ, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમનો વિસ્તાર, ઈન્ડીરાગરીબ નગર, મનહરનગર વિસ્તાર, વલીની ચાલી, લોખંડવાળી ચાલી	
		રખિયાલ	રાજ્યનગર, અંત્યોદયનગર નેળીયુ, મોરારજ ચોક, આચાભાઈની ચાલી, મેડાવાળી ચાલી, બાલા છગનની ચાલી, રામીની ચાલી, સુરધાર-મેધધારા-અમીધારા, રાયપુરમીલની ચાલી, અ મેધ સોસા., સત્યમ ફ્લેટ, પુણાભાઈની ચાલી, પુજારીની ચાલી	
		ગોમતીપુર	મગનકુંભારની ચાલી, સોનીની ચાલી, મોહનની ચાલી, કામદાર મેદાન, હલીમભાઈની ચાલી, મણીયારવાડો,	

		શમશેરબાગ, કુંભારનું ડેહલુ, હોડવાળી ચાલી, હરીજન વાસ, વોરાની ચાલી
	રાજ્યપુર	પ્રિતમહોટલની બાજુમા તથા સામેની ચાલી, હાજી ગફારની ચાલી, ટેવી પ્રસાદની ચાલી, સુદરમનગર, અંસારનગર, ચોક્સીની ચાલી, ભારતીય નગર
	અમરાઈવાડી	શીવાનંદનગર, સલ્બ ક્વાર્ટ્સ, એ. ઈ. સીની સામેવાળો પઢો, ગુલાબનગરનો વિસ્તાર, સવગણ નગર, ગજરાબેનની ચાલી, આનંદ નગર એપાર્ટમેન્ટ, ભીખાદેવાનો વાડો
	ભાઈપુરા	સિધ્યે રી સોસા., પારસનાથ સોસા., શિવશક્તિ નગર, મનહર કોલોની રોડ
	મહાવીરનગર	મહાવીરનગર
	વિરાટનગર	જીવરાજ પાર્ક, પરસોતમનગર, સંજ્ય નગર, સમાજ નવરચના, ચંદ્રભાગા, ઉત્તમનગર, ખોડિયાર યોત, ઉત્તર ઝેન સાઈઝનો પુરો પઢો
	ઓઢવ	ઓઢવ ગામ, જનતા નગર, ઈન્દ્રીરા નગર, સરણીયાવાસ, ગાડોશ કોલોની, હરીઓમ પાર્ક સોસા.
	અર્દુંદાનગર	ભવાની નગર, રબારી કોલોની, કૃષ્ણનગર
	નિકોલ	હરીવીલા ફાલેટ, કર્ણાવતી પાર્ક, શ્યામ ફલેટ, નરનારાયણ ઝુલેકા, નિકોલ ગામ
	વસ્ત્રાલ	ઉમીયાનગર, આદીનાથ નગર, સોમનાથ પાર્ક, સુમીન પાર્ક
	રામોલ	ખાનવાડી, મદની નગર, જનતા નગર, જીમફળ વાડી, વિવેકાનંદ નગર, આયોજન નગર, વિઝોલ ગામ

૧૧. રોગચાળા અંગે લેવાના થતાં પગલાં, સમય અને તેના અમલીકરણ દર્શાવતું પત્રક

ક્રમ	રોગચાળો થવાનું કારણ	લેવાના થતાં પગલા	લેવાના થતાં પગલાનો સમયગાળો	અમલીકરણ વિભાગ
૧	પાણીની લાઈનમાં લીકેજ કારણે ગટરનું પાણી ભળ્યું	પાણીનું સામાન્ય લીકેજ તાત્કાલિક ૨૪ કલાકમાં રીપેર થાય. અને બાકીના કિસ્સામાં તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે.	૨૪ કલાકની અંદર	એ. સી. ઈશ્રી વોર્ડ
૨	ગેરકાયદેસર સોસાયટી અને ચાલી દ્વારા કોર્પોરશનની પાણીની લાઈનમાં ગેરકાયદેસર જોડાણો	ઇજનેર ખાતા દ્વારા જરૂરી નિતી બનાવી ગેરકાયદેસર સોસાયટી અને ચાલીઓને જરૂરી ચાર્જિસ વસુલ કરી, પાછું પાણીનું કનેક્શન આપવામાં આવે તો કોર્પોરશન અને સોસાયટીની લાઈન વેશાનિક ફેઝ જોડી શકાય. કાચા કનેક્શન તાત્કાલિક બંધ કરવા.	જાન્યુઆરી થી માર્ચ	એ. સી. ઈશ્રી વોર્ડ
૩	પ્રાઈવેટ કંપનીના ખોદકામ દરમ્યાન પાણીના કનેક્શનો અને ગટરનું કનેક્શન તુટવાથી	-ટેલીફોન, ગેસ, વીજળી કંપનીના મેનેજરશી સાથે મીટિંગનું આયોજન કરી ખોદકામની જગ્યા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જોનનાં ઇજનેર વિભાગને વિસમાં લઈને ખોદકામની કાર્યવાહી કરવી જેથી પાઈપ લાઈનનું ઓછુ ડેમેજ થાય અને વધુમાં જો લીકેજ માલુમ પડે તો કંપીનીના સાઈટ સુપરવાઈઝરશીએ ઇજનેર ખાતાનું પણ ધ્યાન દોર્યું તથા જોન દ્વારા તાત્કાલીક આવા લીકેજસ રીપેર કરવા અને હેલ્પ ખાતાનું ધ્યાન દોર્યું. -પ્રોજેક્ટની કામગીરી દરમ્યાન જોનનાં સ્ટાફ પણ અવારનવાર સ્થળ મુલાકાત લેતા રહેંનું.	-	મેનેજરશી, બી. એસ. એન. એલ, ટોરેન્ટ પાવર, અદાણી ગેસ લાઈન ડે.સી.ટી. એન્જિનીયરિંગ જોન/ એ. સી. ઈશ્રી વોર્ડ
૪	પ્રોજેક્ટના કામો દરમ્યાન તુટી પાણીની લાઈનો અને ગટર લાઈનો	પ્રોજેક્ટના એન્જિનીયર ડિપાર્ટમેન્ટ સાથે મીટિંગનું આયોજન કરી ખોદકામની જગ્યા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર	-	એડી. સી.ટી. એન્જિનીયરિંગ પ્રોજેક્ટ(વોટર, ફ્રેનેજ, રોડ, હાઉસિંગ સ્લમ), એ. સી. ઈશ્રી વોર્ડ

		વિભાગને વિ સમાં લઈને ખોદકામની કાર્યવાહી કરવી જેથી પાઈપ લાઈનનું ઓછુ તેમેજ થાય અને વધુમાં જો લીકેજ માલુમ પડે તો કંપીનીના સાઈટ સુપરવાઈઝરશ્રીએ ઈજનેર ખાતાનું પણ ધ્યાન દોરં તથા જોન દ્વારા તાત્કાલીક આવા લીકેજ્સ રીપેર કરવા અને હેઠ્થી ખાતાનું ધ્યાન દોરં.		
૫	લો પ્રેશરથી પાણીનો સપ્લાય થવાથી કુંડીનો ઉપયોગ બાબત.	વોર્ડ લેવલે એન્જનીયર ખાતા દ્વારા તેમના વિસ્તારોમાં પાણીની પ્રેસરની લાઈનો ચેક કરવી તથા નિયત પ્રેસર તમામ પાઈપ લાઈનમાં જળવાય તે બાબત સુનિશ્ચિત કરવી.	જાન્યુઆરી થી એપ્રિલ	આસી.સીટી.ઇજનેરશ્રી વોર્ડ
૬	હાઉસીંગના મકાનોમાં જુની પાણીની લાઈનો બદલવી	વોર્ડ લેવલે ૧૫ વર્ષ કે તેથી વધુ જુની પાઈપ લાઈનો બદલવા ચેરમેનશ્રીને સુચનાઓ આપવી તથા પાણીની લાઈન તથા ગટર લાઈન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા હાઉસીંગના મકાનોના ચેરમેનશ્રીઓને ગેરકાયદેસર દબાણો દુર કરવા નોટીસ આપવી અને જરૂર પડે તો એસ્ટેટ ખાતાનો પણ સહયોગ લેવો.	જાન્યુઆરી થી એપ્રિલ	આસી.સીટી.ઇજનેરશ્રી વોર્ડ, પી.એચ.એસ. વોર્ડ, એસ્ટેટ ખાતું.
૭	ગેરકાયદેસર મોટરીંગને કારણે નેગેટીવ પ્રેસર ઉત્પન્ન થવાથી પાણીનું પ્રદુષણ	વોર્ડના આસી.સીટી.ઇજનેરશ્રી દ્વારા તેમના વિસ્તારમાં પાણી સપ્લાયના સમયગાળા દરમ્યાન લો પ્રેસરવાળા ઓળખી બતાવી મોટરીંગ કરતા સખ્ખો સામે બી.પી.એમ.સી એક્ટની કલમો મુજબ મોટર જખી અને અન્ય કાર્યવાહી કરવી. વોર્ડના પી.એચ.એસ દ્વારા આવા વિસ્તારો માલુમ પડે તો આસી.સીટી.એન્જનીનું ધ્યાન દોરં.	ફેફુઆરી થી એપ્રિલ	આસી.સીટી.ઇજનેરશ્રી વોર્ડ, પી.એચ.એસ. વોર્ડ.
૮	પી.વી.સી લાઈનો ને કારણે સાંધા બરોબર ફીટ ન થવાથી પાણીની લાઈન લીકેજ	વોર્ડના આસી. સીટી. એન્જનીશ્રી દ્વારા તેમના વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર સોસાયટીનું મેપીંગ કર્યુ તથા આ માહિતી જોનના એડી. સીટી. એન્જનીશ્રી ને મોકલવી તથા જોનના એડી. સીટી. એન્જનીશ્રી દ્વારા આ પી.વી.સીની પાઈપ લાઈનો કાસ્ટીંગની પાઈપથી બદલવી.	જાન્યુઆરી થી મે	આસી.સીટી.ઇજનેરશ્રી વોર્ડ, ડે.સીટી.એન્જનીશ્રી, એડી.સીટી.એન્જનીશ્રી જોન, સીટી.એન્જનીશ્રી,

		જે તે સોસાયટીમાં તબક્કવાર ચર્ચા કરી મેઈન ટ્રંક થી સંપ ચુધી લાઈનો બદલવા ફરજ પાડવી.		
૮	અમદાવાદ ભ્યુનિ. કોપરેશનની વોટર ડિસ્ટ્રી યુશાન સેન્ટર ખાતેથી અંડર ગ્રાઉન્ડ ટાંકીની સફાઈ	જેનના ઈજનેર ખાતા દ્વારા નિયમિત / વાર્ષિક વોટર પંખીંગ સ્ટેશનની અંડર ગ્રાઉન્ડ ટાંકીઓની સફાઈ નિયમિત પણે ચોમાસા પહેલા અને ચોમાસા બાદ કરવામાં આવે.	માર્ય થી ઓક્ટોબર (પુર જેવી પરિસ્થિતીમાં તાત્કાલિક સફાઈ હાથ ધરવી)	એડી.સીટી.એન્જીશ્રી ઝોન, એડી.સીટી.એન્જીશ્રી(વોટર ઓપરેશન એન્ડ ઇલેક્ટ્રીકલ મેઈન્ટેન્સ)
૯૦	ગટરલાઈન અને ચેમ્બરમાં સીલટ હોવો.	ગટરલાઈનો અને તેના ચેમ્બર સમયાંતરે ડિસીલટ થાય અને જે ચેમ્બરમાં ચોકઅપ હોય તેનું જરૂરી મશીનરી અને જેટીંગ મશીનનો ઉપયોગ કરી ચોકઅપ હુર કરાવડાં તથા વોર્ડમાં કેટલી લાઈનો ડિસીલટ કરી અને કેટલી બાકી છે તેનું રજીસ્ટ્રર નીભાવાં અને નીકળેલ સીલટનો વેજાનિક ફેનેનીકાલ કરવો.	માર્ય થી મે	આસી.સીટી.એન્જીશ્રી વોર્ડ
૯૧	નવી ગટર લાઈનોના સાંધામાં લીકેજસ હોંયું	કોન્ટ્રાક્ટર દ્વારા જયારે ગટરની સિમેન્ટરની પાઈપો નાખવા પામે છે. ત્યારે બે સાંધા વચ્ચે બરાબર સીમેન્ટથી સાધો પુરાય તે બાબતે જરૂરી સુપરવિઝન રાખ્યું		ટેકનીકલ સુપરવાઈઝર વોર્ડ, આસી.સીટી.એન્જીશ્રી.
૯૨	ગટરલાઈનની ચેમ્બરમાંથી પાણીની લાઈન પસાર થવી.	ગટર લાઈનની મેઈન ચેમ્બરમાંથી પાણીની લાઈન પસાર થતી હોયતો તેવા વિસ્તારો ઓળખી બતાવવા તથા પાણીની લાઈન કાપી નાખી ચેમ્બરની બહારથી પસાર થાય તેવી ધવસ્થા ગોઠવવી.	જાન્યુઆરી થી માર્ચ	આસી.સીટી.ઇજનેરશ્રી વોર્ડ, ટેકનીકલ સુપરવાઈઝર અને આસી. એન્જીશ્રી, પી.એચ.એસ. વોર્ડ.
૯૩	ગટરની સુવિધા ન હોય તેવા વિસ્તારમાં પાણીની લાઈન પ્રદુષિત થવાથી	તાકીદે ટી.પી ફાઈનલ થાય તે માટે પ્રયત્ન કરવા ટી.પી. મંજૂર થયેથી તાકીદે ગટરની લાઈન નાખવાનું આયોજન હાથ ધર્યું	આખું વર્ષ	ચીફ.સીટી પ્લાનરશ્રી, એડી.સીટી. એન્જીશ્રી ઝોન, ડે.એસ્ટેટ ઓફીસર ઝોન
૯૪	ડ્રેનેજ પંખીંગ સ્ટેશન બેકીંગ	ડ્રેનેજ પંખીંગ સ્ટેશન બેકીંગ ના થાય તે હેતુસર નિયમીત ચલાવ્યું.	આખું વર્ષ	સીટી.એન્જીશ્રી
૯૫	સોસાયટીના મકાનો, રોડ	સોસાયટીના ચેરમેનશ્રી દ્વારા અને વોર્ડના આસી.સીટી.એન્જીશ્રી દ્વારા	માર્ય થી મે	ચેરમેનશ્રી સોસાયટી અને આસી.સીટી.એન્જીશ્રી વોર્ડ

	લાઈનથી નીચા હોવાને કારણે ગટર લાઈન બેકિંગ હોય તો પાણીનું પ્રદૂષણ થાય.	અનુકૂમે સોસાયટીની ગટર લાઈન અને રોડ લાઈનો સમયાંતરે ડીસીલ્ટ કરાવવાની થાય છે.		
૧૬	સ્ટોર્મ વોટર લાઈનનો અભાવ અને ગટર ઉભરાવવી	ચોમાસા દરમ્યાન નીચાણવાળા વિસાર કે જ્યા ચોમાસાનું પાણી ભરાતું હોય તેવા વિસાર ઓળખી બતાવવા તથા તેવા વિસારોમાં સ્ટોર વોટર લાઈન નાખવાની યવસ્થા ગોઠવવી.	જાન્યુઆરી થી જુન	સીટી. એન્જિનીયર, એડી. સીટી. અન્જલિશ્રી ડ્રેનેજ
૧૭	રોડ વચ્ચે ભુવા પડવાથી પાણીની લાઈન ગટર લાઈન મિક્સ થવાથી	તાત્કાલિક ભુવા પડેલ રોડ ઉપર પાણીની લાઈન લીકેજસ અને ગટર લાઈન ચોકઅપનું કામ તાત્કાલિક અસરથી કરાવાનું તથા પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતું અટકાવાનું	આખું વર્ષ	આસી. સીટી. એન્જિનીયર
૧૮. ૧	શહેરી વિસ્તારમાં ઘરોમાં આવેલા ખાળકુવાના અને શેલો પ્રાઈવેટ બોરના કારણે	ઓડા વિસાર તથા અ. સ્યુ. કો. ના જુના વિસારોમાં ઓડા દ્વારા ખાળકુવાના આધારે સોસાયટીના પ્લાન પાસ કરવામાં આવે છે. આખી સોસાયટી વચ્ચે એક જ ખાળકુવો આવેલ હોય છે. જેથી તેનું આયુષ્ય ઘટી જાય છે. ઓડા દ્વારા સોસાયટી દ્વારા પ્લાન પાસ કરતી વખતે ઘર દીઠ ખાળકુવા અને ઘરની આગળના ભાગમાં અને સોસાયટીના રોડથી એપ્રોય થઈ શકે તેવો હોવો જોઈએ.	માટે-જાન્યુઆરી થી મે	ડ. એસ્ટેટ ઓફિસરશ્રી ઝોન
૧૮. ૨		અ. સ્યુ. કો. માં સમાવિષ્ટ થયેલ નવા વિસારમાં ઈજનેર વિભાગ દ્વારા ગટરની પાઈપલાઈનો નાખવાની કામગીરી તથા વિસારમાં જરૂર જણાય ત્યાં ડ્રેનેજ પંપીંગ સ્ટેશનનું આગોતર આયોજન કરવું જેથી	જાન્યુઆરી થી મે	એડી. સીટી. એન્જિનીયર ઝોન

		ખાળકુવાની સંખ્યામાં ઘટાડો થઈ શકે તેમજ કઈ જગ્યાએ ગટર લાઈન નાખવાની બાકી છે તેનું પ્લાનીંગ એડી.સીટી.એન્જી.શ્રી દ્વારા બનાવડાવવું તેમજ એડી.સીટી.એન્જી.શ્રી (જોન) તથા સીટી. એન્જી.શ્રીને જાણ કરવી.		
૧૮.૩		અ. સ્યુ. કો. દ્વારા ખાળકુવાઓ ખાલી કરવા માટે જરૂરી વાહનની ખરીદી કરવી અથવા કોન્ટ્રાક્ટથી ગાડી ભાડે રાખવી જેથી ખાળકુવા ઉભરાવવાની ફરીયાદોનો અસરકારક રીતે નિકાલ થઈ શકે.	માહે-જાન્યુઆરી થી એપ્રિલ	૩.હેલ્થ ઓફિસરશ્રી (તમામ જોન) અને જે.ડી.એમ.શ્રી
૧૮.૪		ખાળકુવાની ફરીયાદો જ્યાં બાકી હોય તેના કારણો જાણવા તથા જે વિસ્તારમાં ખાળકુવાનું પાણી ઉભરાઈ એકદું થતું હોય અને પાણી પ્રદૂષિત આવતું હોય તેવા વિસ્તારોનું સતત મોનીટરીંગ કરતા રહેવું.	આખું વર્ષ,	૫.હે.સુ. (તમામ જોન)
૧૮.૧	પ્રાઇવેટ બોર થી પાણી સપ્લાય	લો પ્રેસરથી આવતા પાણીને કારણે સોસાયટીમાં પાણી પૂરતા પ્રમાણમાં સાખાય કરી શકાતું ન હોય તેવી જગ્યાએ લોકો દ્વારા યકૃતગત અથવા શેલો બોર બનાવવામાં આવે છે. આવા વિસ્તારમાં એડી.સીટી.ઇજનેરશ્રી (તમામ જોન) દ્વારા પોતાના વોર્ડમાં કઈ જગ્યાએ પાણી લો પ્રેસરથી સાખાય થાય છે તેનું સર્વે કરાવડાવવું અને તેના કારણો જાણી તે તમામ જગ્યાએ એક સરખા પ્રેશરથી પાણી મળી રહે તે માટેની સુ યવસ્થા કરવી. પાણીની લાઈનમાં નિયત અંતરે વાલ્વ મૂકવા	માહે-જાન્યુઆરી થી માર્ચ,	એડી.સીટી.એન્જી.શ્રી(તમામ જોન), એડી.સીટી.એન્જીશ્રી(વોર્ડ ઓપરેશન એન્ડ ઇલેક્ટ્રોકલ મેર્ચિન્ટેન્સ)

		અથવા વોટર પંપીગ સ્ટેશનની કેપીસીટી વધારવી.		
૧૯.૨		ચેરમેનશ્રીને જે તે સોસાયટીના પ્રાઇવેટ બોર ઉપર લીય ડોઝર મશીન મૂકવા માટે વેભિતમાં જાણ કરવી તથા સોસાયટીમાં આવેલ અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં ખાસ્ટરની જગ્યાએ ગ્લેઝ ટાઈલ્સ નાખવા ભલામણ કરાવડાવવી તથા સોસાયટીમાં પી.વી.સી.ની પાઈપલાઈન ગટરની લાઈનથી ઉપરના ભાગે હોય અથવા પ ફૂટના અંતરે નાખવા માહિતગાર કરવા.	માહે: જાન્યુઆરી થી મે	ડ.ડ.ઓ.શ્રી, પ.ડ.સુ., આ.સીટી.અન્જી.શ્રી વોર્ડ એડી.સીટી.અન્જીશ્રી(વોટર ઓપરેશન એન્ડ ઇલેક્ટ્રોકલ મેઇન્ટનેસ)
૧૯.૩		યક્તિગત શેલો બોરનો સર્વે કરાવડાવવો તથા આવા યક્તિગત લોકોને શેલો બોરની જગ્યાએ કોપોરિશનનું પાણી મળે તેવી યવસ્થા ગોઠવવા સમજાવવું અને અમલ કરાવડાવવો અને જો આ શક્ય ન હોય તો સોસાયટીના ઉડ બોરમાંથી કલોરીનેશન કર્યા બાદ પાણી સપ્લાય થાય તેવી યવસ્થા કરવી.	માહે:જાન્યુઆરી થી મે	પ.ડ.સુ., આ.સીટી.અન્જી.શ્રી વોર્ડ
૨૦.૧	કલોરીનેશન પૂરતા પ્રમાણમાં ન થવું:	અમદાવાદના ફક્ત ૮૦% વિસ્તારમાં કલોરીન્યુક્ટ પાણી સપ્લાય કરવામાં આવે છે જેથી ૧૦% વિસ્તારમાં સર્વે કરાવડાવી તે વિસ્તારોમાં પણ કલોરીન્યુક્ટ પાણી પહોંચે તે બાબત સુનિશ્ચિત કરવી.	માહે:જાન્યુઆરી થી માર્ચ	સ્પે.સીટી.અન્જી.શ્રી
૨૦.૨		અમદાવાદ ખુનિસિપલ કોપોરિશન વિસ્તારોમાં બોર ઉપર લીય ડોઝર મશીનથી કલોરીનેશન યુક્ટ પાણીનો સપ્લાય કરવામાં આવે છે. જેમાં અમુક સમયે લીય ડોઝર મશીન બગાલું	માહે:જાન્યુઆરી થી મે	એડી.સીટી. અન્જી.શ્રી (તમામજોન),

		<p>હોવાથી અથવા કલોરીનનું દ્વારા પુરે થઈ ગયેલ હોવાથી કે કલોરીનના દ્વારાણા ટ્રાન્સપોર્ટેશની યવસ્થાના અભાવે કલોરીનયુક્ત સપ્લાય થઈ શકતું નથી. જેથી કલોરીન વગરનું પાણી જે તે વિસ્તારમાં પહોંચે છે. તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર ઉપર નિયમિત કલોરીનેશન થાય તે બાબત સુનિશ્ચિત કરવી.</p>		એડી.સીટી.એન્જિશ્રી(વોટર ઓપરેશન એન્ડ ઇલેક્ટ્રીકલ મેઇન્ટેનાન્સ)
૨૧	<p>ચામુંડા બ્રિજથી લઈને કાંકરીયા સુધીની ડ્રેનેજ લાઈન તથા નરોડાથી લઈને પીરાણા સુધી ડ્રેનેજ લાઈન સાફ્ કરાવવી.</p>	<p>સે.સીટી ઇજનેર દ્રારા ચામુંડા બ્રિજથી શરૂ કરીને કાંકરીયા સુધીની ડ્રેનેજ લાઈનને તથા નરોડાથી લઈને પિરાણા સુધીની ડ્રેનેજ લાઈનને તાત્કાલિક અસરથી ડિસીલ્ટ કરાવવી જેથી ઉત્તર, પૂર્વ, દક્ષિણાના કમળાના અસરગ્રસ્ત વિસ્તારમાં ગટર લાઈનનું બેકોંગ નિવારી શકાય. તથા ભવિષ્યમાં સમયાંતરે ડિસીલ્ટ કરાવતા રહેંનું</p>	જાન્યુઆરી શ્રી જુન	સીટી. એન્જિશ્રી

૧૨. હેલ્થ ખાતા દ્વારા કમળાના રોગચાળો અટકાયતી પગલાનો માસ વાઈજ કાર્યક્રમ

ક્રમ	માસ	લેવાના થતા પગલા
૧	જાન્યુઆરી થી એપ્રિલ	<ul style="list-style-type: none"> તમામ મેડિકલ ઓફીસરશ્રી એ પોતાના વૉર્ડનો નકશો બનાવી પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાના જુદા જુદા રોગનું વિસાર વાઈજ મેપીંગ કરવાનું શરૂ કરવાનું રહેશે. પોતાના વિસારમાં હાઈરીઝ એરીયા શોધીને મદ્દી પરપઞ્ચ હેલ્થ વર્કર અને આંગણવાડી વર્કરનો સહકાર મેળવી હાઈરીઝ વિસારોમાં અઠવાડીયામાં બે વાર મહિલાઓ સાથે ગૃહ મિટીંગ કરવી. તથા મહીનાના બીજા ગુરુવારે થતો રસોઈ શો નો પણ ઉપયોગ કરી શકાય. હાઈરીઝ વિસારોમાં વૉર્ડ લેવલે વધારે સેમ્પલ લેવડાવવા.
૨	ફેબ્રુઆરી થી એપ્રિલ	<ul style="list-style-type: none"> જોન લેવલથી પાણીજન્ય રોગચાળો જેવા કે જાડા- ઉલ્ટી, કમળો, ટાયફોઇઝ, કોલેરા વગરે રોગો સામે લોકોમાં જાગૃતિ આવે તેના માટે માઈક દ્વારા પ્રચાર-પ્રસાર કરવો. પોતાના જોનમાં આવેલા કોરોનાશનના બોર ઉપર નિયમિત કલોરીનેશનનું મોનીટરીંગ અઠવાડીક કરું તથા તે બાબતે જરૂર જણાય તો એડી.સી.ટી. ઈજનેરશ્રીના લાયજનમાં રહેં. તમામ પી.એચ.એસ., એસ.આઈ., એસ.એસ.આઈ., ની મીટિંગ બોલાવડાવવી જોનમાં થતા કોઈપણ પ્રકારના ખોદકામ બાબતે માહિતગાર કરી ખોદકામ રજીસ્ટ્રર નિભાવું તથા આસપાસના વિસારોમાં પાણીના સેમ્પલો કલોરીનેશન, પ્રદૂષિત પાણીની ફરીયાદો વગરે બાબતે ઉપર ખાસ તકેદારી રાખવા સ્ટાફને જરૂરી સુચના આપવી.
૩	માર્ચ	<ul style="list-style-type: none"> વૉર્ડ લેવલે ફેબ્રુઆરીના મહિનામાં બતાવેલા પગલાનો અસરકારક અમલ કરાવડાવો. હાઈરીઝ એરીયામાં પાણીના સેમ્પલ અને કલોરીનેશનનું મોનીટરીંગ સધન કરું. વિસારમાંથી આવતી પાણીની પ્રદૂષિત અને ગટર ઉભરાવવાની ફરીયાદો બાબતે સંબંધિત ડે.હેલ્થ ઓફીસરશ્રી, અને વૉર્ડના આસી.સી.ટી. એન્ઝશ્રીનું ધ્યાન દોરું. ડે.હેલ્થ ઓફીસરશ્રી દ્વારા ફૂડની સ્કવર્ડ બનાવડાવી ખાણીપીણીના બજારો તથા રાત્રી ખાણીપીણીના બજારો પર સધન નજર રાખવી. ટી.વી.રેડીયો, ચેનલ દ્વારા જરૂરી રોગચાળા અટકાયતી જાહેરાત કરવી. તમામ સ્લબ, ચાલી વિસારમાં બે રાઉન્ડ ધનિષ્ઠ સફાઈનું આયોજન કરું. જોનમાં આવેલ તમામ બરફ બનાવતા કારખાનાની ચકાસણી તથા પાણીના નમુના લેવા.
૪	એપ્રિલ	<ul style="list-style-type: none"> ફૂડ સ્કવર્ડ દ્વારા જરૂરી ખાણીપીણી બજારોનું ધનિષ્ઠ ચેકીંગ કરું.

		<ul style="list-style-type: none"> મેડિકલ ઓફીસર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમામ વિસ્તારોમાં જરૂરી આઈ.ઈ.સી કરાવી. તમામ સકારી મકાનો, ઓફિસો, થિયેટરો, શાળાઓ, તથા સોસાયટીમાં આવેલી અંડર ગ્રાઉન્ડ ટાંકી અને ઓવર હેડ ટાંકીઓ સાફ્ કરાવવા લેખિતમાં જાણ કરવી. કુડ હેલ્દર્સની સ્વાસ્થ્યની ચકાસણી કરાવડાવવી.
૫	મે થી ઓગષ્ટ	<ul style="list-style-type: none"> જરૂરી જંતુનાશક દવાઓ, કલોરીન ગોળીઓ, ઓ.આર.એસ પેકેટનો સંગ્રહ કરવો. બરફનો ઉપયોગ થતા હોય તેવા ધંધા જેમ કે શેરડીનો રસ, જયુસ સેન્ટરો, તરુચ, બરફના ગોળાવાળા અને પકોરીવાળાના ત્યા તમામ પ્રકારની આરોગ્ય વર્ધક સ્થિતિ જણવાય તે માટે અસરકારક પગલા ભરવા. કલોરીન નીલ આવતું હોય તેવા વિસ્તારોમાં કલોરીન ગોળીનું વિતરણ કરાવડાવું. પાણીજન્ય રોગચાળા અંગે છાપામાં, લોકલ ન્યુઝ પેપરમાં અને ટીવી ચેનલોમાં રોગ અટકાયતી પગલા ભરવા. કુડ ખાતા દ્વારા જરૂરી સેમ્પલની સંખ્યા વધારવી.
૬	જુન થી સપ્ટેમ્બર સુધી	<ul style="list-style-type: none"> તમામ સકારી મકાનો, ઓફિસો, થિયેટરો, શાળાઓ, તથા સોસાયટીમાં આવેલી અંડર ગ્રાઉન્ડ ટાંકી અને ઓવર હેડ ટાંકીઓ બરાબર સાફ્ થયેલ છે કે નહી તે સુનિશ્ચિત કરવું. કલોરીન ન આવતું હોય તેવા વિસ્તારો ઓળખી બતાવવા અને તેવા વિસ્તારમાં કલોરીન ગોળીઓનું વિતરણ કરાવવું. મેડિકલ ઓફીસર દ્વારા જરૂરી આઈ.ઈ.સી પ્ર ગૃન્ટિ કરાવવી. વોર્ડ ફીઠ જંતુનાશક દવાનો જથ્થો અને કલોરીન ગોળીઓનો જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તેવી યવસ્થા ગોઠવવી.
૭	સપ્ટેમ્બર થી નવેમ્બર સુધી	<ul style="list-style-type: none"> ધ્યાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખી રાની ખાણીપીણી બજારનું કુડ સ્કોડ દ્વારા ધનિષ્ઠ ચેકિંગ કરવું. મિટાઈ ફરસાણ તથા ખાંધ પદાર્થો બનાવતા ધંધાકીય એકમો ઉપર સ્વચ્છતા અને એફ.એસ.એ એકટના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરવી.
૮		<ul style="list-style-type: none"> આખા વર્ષ દરમ્યાન ન્યુશાનસની જગ્યાએ નિયમિત સફાઈ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો. તમામ પ લીક જાજર તથા પેશાખખાનામાં નિયમિત સફાઈ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો. કચરા પેટી (કન્ટેનર) સાઈટની નિયમિત સફાઈ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
ઉપરોક્ત તમામ હેલ્થ ખાતા દ્વારા થતી કાર્યવાહી નિયમિત પણે વર્ષ દરમ્યાન સતત થતી રહે તે બાબત નાયબ આરોગ્ય અધિકારી જોન દ્વારા મોનીટરીંગ અને સુનિશ્ચિત કરતા રહેં.		

૧૩. અ.મ્યુ.કો.માં નોંધાયેલ છેલ્લા બે વર્ષના એપીડેમીકના કિસ્સાઓ

	વર્ષ-૨૦૧૦માં નોંધાયેલ કિસ્સાઓ	વર્ષ-૨૦૧૧માં નોંધાયેલ કિસ્સાઓ
જાડા - ઉલ્ટી	૮	૧
કમળો	૬	૧૩
કુડ પોઈઝનીંગા	૧	૨
કુલ	૧૫	૧૬

ઉપરોક્ત કોષ્ટક મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વર્ષ-૨૦૧૦માં કુલ ૧૫ એપીડેમીક કિસ્સાઓ નોંધાયેલ હતા જેમા ૮ કિસ્સોઓ જાડા-ઉલ્ટીના, ૬ કિસ્સાઓ કમળાના અને ૧ કિસ્સો કુડ પોઈઝનીંગના છે. જ્યારે વર્ષ-૨૦૧૧માં કુલ ૧૬ એપીડેમીક કિસ્સાઓ નોંધાયેલ હતા જેમા ૧ કિસ્સોઓ જાડા-ઉલ્ટીના, ૧૩ કિસ્સાઓ કમળાના અને ૨ કિસ્સો કુડ પોઈઝનીંગના છે. વધુમાં વર્ષ-૨૦૧૧માં નોંધાયેલ કેસોમાં ૪ એપીશોડ ઠક્કરનગર વોર્ડમાં નોંધાયેલ છે. જ્યારે ૪ એપીશોડ પૂર્વ ઝોનમાં નોંધાયેલ છે. જેના કારણે વર્ષ-૨૦૧૧માં કમળાના રોગચાળાનો ગયા વર્ષ કરતા વધારો નોંધાયેલ છે.

વર્ષ-૨૦૧૧માં નોંધાયેલ ઝોન વાઈઝ કમળાના કિસ્સાઓ

ઝોનનું નામ	નોંધાયેલ કમળાના કિસ્સાઓ	નોંધાયેલ કમળાના કેસો	ટકાવારી
પશ્ચિમ	૨	૭૮	૮.૪
પૂર્વ	૪	૨૬૨	૩૧
દક્ષિણ	૦	૦	૦
ઉત્તર	૪	૨૭૭	૩૩
નવા પશ્ચિમ	૨	૬૦	૧૧
મધ્ય	૧	૧૨૬	૧૫
		૮૩૩	૧૦૦

૧૪. પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે ત્યારે લેવાના થતા પગલા

રોગચાળો

અસામાન્ય પરિસ્થિતમાં જ્યારે કોઈ પણ પ્રકારના કેસોનું પ્રમાણ જે તે વિસ્તારમાં નોંધાતા સામાન્ય કેસોની સરખામણીમાં અચાનક વધી જવા પામે ત્યારે તેને રોગચાળો ફેલાયો છે, તેમ કહી શકાય. અમદાવાદ શહેરમાં સૈથી મોટું પાણીનું નેટવર્ક, ગાટરનું નેટવર્ક, ખાણીપીણીના બજારો, શહેરીકરણ, સ્લમ પોષ્યુલેશનના ભાગ રૂપે અલગ અલગ સમયે કોઈ ચોક્કસ વિસ્તારમાંથી પાણીજન્ય રોગચાળો જેવા કે જાડા ઉલ્ટી, કમળો, ટાયફોઇન, કોલેરા જેવા કેસો ફાટી નીકળતા હોય છે. ત્યારે આવા કિસ્સાઓમાં જ્યારે રોગચાળો કોઈ એક વિસ્તારમાં સીમીત હોય ત્યારે ખાસ પ્રકારના પગલા ભરવામાં આવે છે. જેનાથી રોગચાળો કાંપું મેળવવા માટે અને ભવિષ્યમાં તેને અટકાવવાં માટે શું પગલા ભરી શકાય તે જાણી શકાય છે.

હેલ્થ અને ઈજનેર ખાતા દ્વારા લેવાના થતાં પગલા

૧. રોગચાળામાં રોગની ખરાઈ

જ્યારે વિસ્તારમાંથી રોગચાળાની માહિતી જોન લેવલે / વોર્ડ લેવલે પ લીક, પ્રેસ, પોલીટીક્સ તરફથી આપવામાં આવે ત્યારે મેડીકલ ઓફીસર વોર્ડ દ્વારા અથવા ડે. હેલ્થ ઓફીસર / આસી.હેલ્થ ઓફીસર દ્વારા સ્થળ તપાસ કરાવડાવી શક્ય હોય તો માહિતી આપનારની હાજરીમાં અસરગ્રસ્ત કેસોની મુલાકાત લઈ રોગચાળામાં કયા પ્રકારનો રોગ છે. તેની ખરાઈ કરાવવી અર્બન હેલ્થ સેન્ટરના લીંક વર્કર અને મલ્ટી પરપાઝ હેલ્થ વર્કરો દ્વારા પોતાની ફીલ્ડ ડ્યુટી વખતે આવા કોઈ કેસો ધ્યાનમાં આવે તો તાત્કાલિક ઉપલા અધિકારીશ્રીનું ધ્યાન દોરું જરૂરી બને છે.

૨. રોગચાળો ફેલાયાની ખરાઈ કરવી.

એકવાર રોગની ખરાઈ થયા બાદ ખરેખર તે વિસ્તારમાં કેસોની સંખ્યા વધુ છે. તથા આ રોગની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં વધુ છે તે નક્કી કરી રોગચાળો ફેલાયો છે કે કેમ તે નક્કી કરી શકાય છે. આ માટે સ્થાનિક રહીશો, કાર્યકર્તા અને આગેવાનોને પુછીને પણ રોગોના અંદાજીત કેટલા કેસો છે. તે જાણી શકાય છે.

૩. કેટલા લોકો અસરગ્રસ્ત છે તે યાખ્યાઈત કરું.

- વિસ્તારનો નકશો મેળવવો તથા મેળવેલી માહિતીને આધારે ક્યો વિસ્તાર અસરગ્રસ્ત પામેલો છે. તેને નોંધું તથા આ અસરગ્રસ્ત વિસ્તારની આસપાસ આવેલા તમામ સોસાયટી, ચાલીઓ, બંગલોઝને પણ સર્વેમાં આવરી લેવાના થાય છે. જેથી રોગના કેસોનો સાચો અંદાજ મેળવી શકાય અને એક પણ કેસ છુટી ન જવા પામે.
- વધુમાં વિસ્તારમાં પાણી સપ્લાય અને ગટરની લાઈનનું મેપીંગ કરી સંભવિત બ્રેક ડાઉન શોધું.
- વિસ્તારની વસ્તી ગણવી એકવાર નકશામાં નોંધ થયા બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં અંદાજીત કેટલા ઘરો આવેલા છે તથા તેની આસપાસની સોસાયટી, ચાલીઓ અને જુપડપડીમાં બીજા કેટલા ઘરો થાય છે. તેની ચોકક્સ સંખ્યા નક્કી કરવી જેથી કરીને જરૂરી સર્વે માટે કેટલી મેડીકલ ટીમ અને કન્ટીજન્સીની જરૂર પડશે તે નક્કી કરી શકાય.

૪ રોગચાળા સંબંધિત કેસોના સર્વે બાબત.

- મેડીકલ સર્વે:- લીંક વર્કર કે સેનીટરી સ્ટાફ દ્વારા સર્વે ફોર્મેમાં ઉપરોક્ત મુદ્દામાં દર્શાવેલ અસરગ્રસ્ત વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં રોગોના ચિહ્નોના આધારે દરેક ઘરોના રોગના કેસના નિદાન માટે સર્વે કરાવવો જરૂરી છે. જેનાથી સાચી રોગના કેસોની સંખ્યા મળી શકે.
- સર્વે ફોર્મેમાં પેશાન્ટનું નામ, ઉંમર, જાતિ, રહેઠાણનું સરનામું, કોઈ હોસ્પિટલમાં દાખલ હોય તો તેની વિગત, લેબ રિપોર્ટની વિગત અને કયા પ્રકારના રોગના ચિહ્નો છે. જેવી વિગતોની માહિતી મેળવવાની રહેશે. જેથી રોગચાળો થવાના કારણો કયા વસ્તીના પ્રકારમાં જેમ કે સ્ત્રી, પુરુષ, મોટા માણસો, નાના બાળકો કે કોઈપણની જાતીમાં રોગ થાય છે તે જાણી શકાય.
- વધારાના નવા કેસો શોધવાઃ- અસરગ્રસ્ત વિસ્તારની આજુબાજુની સોસાયટી, ચાલી કે જુપડપડીમાં પણ સર્વે કરાવડાવી અન્ય કસોને શોધવા તથા જે તે વિસ્તારની પ્રાઈવેટ કે જનરલ હોસ્પિટલ તથા પ્રાઈવેટ લેબનો સર્વે કરાવડાવી અન્ય વિસ્તાર અસરગ્રસ્ત થયો છે કેમ તેની માહિતી મેળવવી.

૫ ડેટા એનાલીસીસ કરું.

આવેલ કસોની માહિતીનું યક્ષિત પ્રમાણો, જગ્યા પ્રમાણો અને સમય પ્રમાણો પૃથ્વીકરણ કરીને નકશો બનાવવાનો થાય છે. જેનાથી સંભવિત ક્યા પ્રકારનો રોગચાળો છે, કેટલા વિસ્તારમાં પ્રસરેલો છે, ક્યા સુધી રોગચાળો ચાલશે, કઈ યક્ષિતઓ વધારે હાઈરીઝ ઉપર છે. વગેરે જેવી માહિતી મેળવી રોગ અટકાયતી પગલા લઈ શકાય છે.


૬ સંભવિત કારણ

- ઉપરોક્ત માહિતના આધારે રોગચાળો શેના કારણો ફેલાયો છે. તેનું પ્રાથિમિક તારણ નીકાળી તેને દુર કરવા જરૂરી પગલા ભરી શકાય જેમ કે કુડ પોઇઝનીંગના કિસ્સામાં વાસી કે સડેલો ખોરાક ઓળખી બતાવી જરૂરી નમુના લેવડાવી તેના ઉત્પાદક સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવી અસરગ્રસ્તોને નજીકની સરકારી કે મ્યું. હોસ્પિટલમાં સિફટ કરાવડાવી સારવાર આપી શકાય છે.
- કમળો થવાના કારણમાં ૧૫ દિવસથી લઈ ૨ મહિના સુધીના ગાળામાં અસરગ્રસ્ત વસ્તી દ્વારા પ્રદુષિત પાણી પીવાથી કમળો થાય છે. જેમા ગેરકાયદેસર પી.વી.સી લાઈનો, ગટર ઉભરાવવી, રોડ અને પ્રોજેક્ટના ખોદકામ દરમ્યાન પાણી અને ગટર લાઈનો તુટવી વગેરે કારણો ને કારણે પીવાનું પાણી પ્રદુષિત થવાથી રોગચાળો ફેલાઈ શકે છે. જે માટે જરૂરી ઈજનેર ખાતાને લેખિતમાં જાણ કરવી. તથા સમયસર ફોલોઅપ કરું અને પીવાનું પાણી ટેન્કરથી પુરુ પાડું.

૭. મેડીકલ કોલેજ સાથે સંકલનમાં રહીને રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા સર્વે કરાવડાવું તથા જરૂરી નમુના જેવા કે લડ, સ્ફુલ અને વોમીટના નમુના મેળવી એન. એચ. એલ બાયોલોજી લેબ. ખાતે ક્યા પ્રકારનો રોગચાળો છે તે કન્ફોર્મ કરવા સેમ્પલ મોકલી આપવા.

૮. આરોગ્ય ખાતા દ્વારા જરૂરી રોગ અટકાયતી પગલા નીચે મુજબ લેવા.
- કલોરીન ગોળીનું ધરેઘરે વિતરણ કરાવડાવી અને કલોરીન ગોળીઓનો કર્દ રીતે ઉપયોગ કરવો તેની સમજ આપવી જેમા કલોરીન ગોળીઓ ભુકો કરીને માટલામાં નાખ્યાં બાદ અડધો કલાક બાદ પીવાનું પાણી ઉપયોગમાં લેં.
 - આરોગ્ય પત્રિકાની વહેચણી કરવી.
 - સોસાયટીના ચેરમેનશ્રી સાથે, સભાસદો સાથે, મહિલાઓ સાથે ગૃહ મીટિંગ કરી રોગચાળો થવાનું કારણ, રોગથી બચવા પાણી ઉકાળીને પીં, જનરલ સ્વાસ્થ્ય વર્ધક પરિસ્થિતી જાળવી રાખવી, સાચુથી હાથ ધોવા વગેરે જેથી પ્રાથમિક માહિતી આપવી. ચેસાયટીના નોટીસ બોર્ડ પર જરૂરી રોગ અટકાયતી સુચનાઓ લખવી.
 - પ્રાઇવેટ હોસ્પિટલની લેબોરેટરીનો સર્વે કરાવડાવવો.
 - જરૂરી ખુલ્લામાં વેચાતા વાસી ખોરાક નાશ કરાવવો, જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
 - પાણીના સેમ્પલ લેવડાવવા.
 - મેડીકલ ટીમ દ્વારા સ્થળ પર સારવાર આપવાની યવસ્થા કરવી અને જરૂર લાગે તો હાઈરીઝ કેસો જેવા પ્રેનેન્સીને તાત્કાલિક સરકારી કે મ્યુ. જનરલ હોસ્પિટલમાં રીફર કરવા.
૯. ઈજનેર ખાતા દ્વારા જરૂરી નીતિ બનાવી ગેરકાયદેસર સોસાયટી અને ચાલીઓને જરૂરી રેવન્યુ ભરાવડાવવી તથા પાકું પાણીનું કનેક્શન આપવામાં આવે અને પાણીની લાઈન વોસ આઉટ તથા ગટરની લાઈનું ડીસીલટ કરી પીવાના પાણી ટેકરથી પાણી પુરુ પાડિં અને પાણીના સેમ્પલ લેવડાવવા.

15. Water Pollution Complaints / Redressal System & Diseases Surveillance



**1st. Department of Community Medicine,
Smt. NHL Municipal Medical College, Ahmedabad,**
Phone: 079-2657 62 75 (208)
Fax: 079-2657 92 82 Attention: Professor & Head, Community Medicine Dept.

ACTION PLAN FOR PREVENTION OF JAUNDICE EPIDEMICS

Appropriate housing, safe water supply and proper sanitary measures for waste disposal are the great environmental challenges faced by the persons living in Ahmedabad. The zones viz. East, North and South and are densely populated and also have maximum number of slums and chawls where overall environmental sanitation is poor. Therefore, several wards in these zones witness outbreaks of water, food and vector borne diseases frequently.

The routine IDSP reports collected from UHCs, the teaching hospitals of AMC and some important private hospitals provide data of the common Communicable diseases (viz. Ac. Gastro-enteritis, Jaundice, Cholera, Fever, Typhoid, Malaria, Dengue etc.) are reviewed and appropriate action for prevention and control of these conditions are taken.

An action plan is prepared for prevention and control of Jaundice outbreak in particular.

Early warning signals for Event-based Surveillance is done by through routine UHC data and those reported by Link workers and MPWs and M.O of UHC to the health department.

Hepatitis A & Hepatitis E

An acute infection with a Hepatitis virus may result in conditions ranging from subclinical disease to self limited symptomatic disease to fulminant hepatic failure.

Case Definition:

SUSPECT: Viral Hepatitis is an acute illness which causes yellow colouring of eyes, skin and dark urine.

PRESUMPTIVE / CLINICALLY Confirmed:

- Acute onset, fever of short duration followed by jaundice, malaise, anorexia, hepatomegaly, & abdominal tenderness in the right upper quadrant.
- Increase in ALT >2.5 times and S. Bilirubin >2 mg% and
- Epidemiological link or outbreak in area of residence of a case.

LABORATORY Confirmed: Serological tests are necessary to identify type of virus.

- **Hepatitis A and Hepatitis E** (Enterically transmitted Non A Non B)

- In Public Health (PH) terminology Jaundice is synonymous with Viral Hepatitis.
- Hepatitis is an important PH problem in India and particularly in Ahmedabad.

Both are transmitted by fecal-oral route

Hepatitis A

Epidemiology

Agent: Hepatitis A virus, (enterovirus type 72)

Incubation Period: 15-45 days (30 days)

Host factors:

- Common in Children, but infections tend to be subclinical or mild
- People from all ages can be affected if susceptible with Mild or without clinical symptoms,
- Clinical severity increases with age
- Linked with Hygiene/Sanitation conditions
- Typical Sign & Symptoms clinically seen in adults
- Mortality <1%
- Control of reservoir is difficult as fecal shedding is highest during incubation period.

Environmental factors: Cases occur throughout the year.

More cases in rainy season

Poor sanitation & overcrowding favour spread of infection

Prevention & Control of transmission:

- Hand washing before eating & after toilet
- Good personal and food hygiene
- Sanitary disposal of excreta: provision of sanitary latrines in slums/ chawls,

- provision of pay and use latrines if sanitary latrines are not adequate

Immunity : Immunity to HAV (Hepatitis A Virus) may exceed 95% in adult population

Vaccine For Hepatitis A:

In India Immunity to HAV is natural immunity that is acquired in childhood. Moreover, all outbreaks are due to HEV (Hepatitis E Virus) and hence there is limitation of the use of HA.

Prevention & Control of transmission:

Normal Doses of Chlorination do not destroy Hepatitis A virus:

1 mg/liter of free Residual Chlorine can cause destruction of virus in 30 minutes at pH 8.5 or less and ensure safety against Hepatitis A. (ref: Park's Text Book of PSM by Park XIX Edition page 174)

Virus is inactivated by boiling for five minutes or UV light

During epidemics, boiled water should be advocated for drinking purpose till such time the source of contamination is removed.

Hepatitis E

(Enterically transmitted Non A Non B)

Epidemiology

Common cause of Outbreaks of Jaundice in India is HEV (Hepatitis E Virus)

Common cause of Fulminant Hepatitis in adults in India and other parts of Asia (mortality ranges from 0.5 to 4% and in pregnant women mortality is 80%)

Agent: Hepatitis E virus, discovered in 1990

Incubation Period: 15-60 days (40 days)

Host factors: More often in young adults (15 - 40 years)

Causes complications and high fatality (Acute fulminant hepatitis)

(Case Fatality Rate high in pregnant women 20-40%)

>50% cases remain anicteric. Fever disappears when Jaundice appears.

Alter Liver tests (ALT) > 2.5 times of upper limit and Serum bilirubin >2 mg%

Environmental factors:

- No person to person transmission
- Hepatitis E virus detected in animal excreta. (Cows, Goats, Pigs, Rodents)
- Water sources polluted by animal waste.
- Single case in most of the household
- Majority (80%) cases over 15 years and above
- Males contribute to ¾ of cases
- Outbreaks during rainy seasons
- Outbreaks subside in few weeks once leakage identified and corrected.

Diagnosis : Anti - HEV antibodies in serum; no confirmatory assay is available

Treatment: No specific treatment. Only supportive measures are required

Vaccine: No vaccine or specific immunoglobulin prophylaxis is available

Prevention & Control of transmission:

Action against Hepatitis A and Hepatitis E

- Ensure water quality monitoring on regular basis (Residual chlorine not less than 1.0 ppm in the system)
- **IEC activities - Multiple TV channels** to disseminate the health related messages on a regular basis in local vernacular
- IEC activities by Health staff (Paramedical staff) in the form of group discussions in the community
- Sanitary surveys by Health staff for sewage and solid waste management
- Inspection of drainage/ water supply by Public Health Engineering
- Scrutiny of infectious diseases under IDSP (Integrated Disease Surveillance Project) by Medical Officers of UHCs, Hospitals for Jaundice and anticipatory prevention activities.

Actions to be taken by Public Health Engineering Department

- During investigations of outbreaks in AMC area by us (our department faculty) it was observed that in the area of outbreak, there are breaches in the old pipes of water supply and drainage pipes leading to contamination of water supply. Again in some low lying areas there polluted water collection would contaminate of water supply.
- Public Health Engineering Department should take active part in the implementation of the following measures for prevention and control of these communicable diseases.
- Piped water supply managed by Public Health Engineering Department available to different slums and chawls and also illegal water connections taken by the households.
- At several places, it was observed that due to low pressure of water, hand pumps or Electric motors are used to pump water.
- Facility of Sanitary latrines accessibility (Pay and Use Facility) should be made accessible where there are no adequate facilities in the slums
- Illegal water connection households. should be cut and should be replaced by legal water connection. Till it is implemented, safe water be provided through tankers on regular basis
- Replacement of old water pipes and old drainage pipes with new ones
- Any breach in the pipe line should be intimated to the AMC authority for timely repairs.
- Open field defecation practiced by small children by some households in slums (even though it is uncommon in the recent times) should be stopped by intensive IEC activities by the health department.

All these measures would eliminate other diseases as well, viz. Diarrhoeal diseases, Ac. Gastro-enteritis, Cholera and Typhoid

To conclude, Public Health Engineering Department's contribution will make a significant difference in prevention and control of outbreaks of water, food and vector borne diseases and promotion of the health of people of Ahmedabad.